

## ۱۱ اوام شري پِرماتمني نَمَه

### اَتَ اِشْتَدَّ دُشُو ذِيَايَهِ

هيءَ گيتا جو انتم اذيايه آهي، جنهن جي پھرئين اذ ڦيو گيشور شري ڪرشٽ دواران ڏنل اُديش ۾ انيك سوالن جو سماڻا ان آهي ئ بيو اذ گيتا جو آخرین اُپكتا آهي تم گيتا مان لاي ڪھڙو آهي؟ سترهين اذياء ۾ آهار (کادو) تپ، يگيء، دان ئ شردا جو وياڳه سهت سوروب ٻڌايو ويو، انهي نسبت ۾ تياڳه جا پرڪار باقي آهن. منش جيڪو ڪجهه ڪري ٿو، ان جو ڪارڻ ڪير آهي؟ ڪير ٿو ڪرائي؟ ڀڳوان ٿو ڪرائي يا پرڪرتى؟ اهي سوال پھرين کان ئي شروع آهن، جنهن تي هن اذياء ۾ وري پرڪاش وڌو ويو. ان طرح ورڻ ويستا جي چرچا ٿي چكي آهي. سرشتىء ۾ انجي سوروب جو چيد هن اذياء ۾ بيان ڪيل آهي. انت ۾ گيتا مان ملڻ واريون ويوقين تي پرڪاش وڌو ويو آهي.

اڳئين اذياء ۾ انيك پرسنگن جو وراهست بدی ارجن پاڻ هڪ سوال رکيو تم تياڳه ئ سنپاس کي به وياڳه سهت ٻڌايانؤون.

#### ارجن اُواچ

سَنْنَيَا سَسْ�َ مَهَابَاهُو تَطْمِيَّهِ مِنْجَامِي وَيَدِيَّهُ  
त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन ॥१॥

#### ارجن اُواچ

”سنپاسيمه مها باهو تَطْمِيَّهِ مِنْجَامِي وَيَدِيَّهُ  
تياڳسيمه چه هرشيکيش پر ٿکيسيينشودن ۱۱۱ (۱)  
ارجن چيو:- هي مها باهو ! هي دل جا مالڪا هي ڪيشي

નિશ્ચુદુન ! માન સન્યાસ આ ત્યાંગે જી યત્તરાત સુરોપ કી આહુસ્તી આહુસ્તી જાણ્ણ ચાહીયાન ત્થી કુદ્ર કુદ્ર ત્યાં સુધીજાણ્ણ ચાહીયાન ત્થી. પૂર્વે ત્યાંગે સન્યાસ આહી, જ્યે સન્કલ્પ આ સન્સકારન જી બે પૂર્વાંગી આહી આ અન હુદ્ર પુર્વીન સાંજના જી પૂર્વાંગી લાએ ગુહ્ણો આ ગુહ્ણો આસુંતી જો ત્યાંગે ત્યે ત્યાંગે આહી. હેતી બે સુઓ આહે તે સન્યાસ જી ત્તો કી જાણ્ણ ત્થી ચાણ્ણ ત્થી ચાહીયાન આ બ્યુ આહી તે ત્યાંગે જી ત્તો કી જાણ્ણ ત્થી ચાહીયાન. અન ત્યી યોગીશુર શ્રી કરુણાંભુજ ચિંતા

### શ્રીભગવાનુવાચ

કામ્યાનાં કર્મણાં ન્યાસં સન્યાસં કવયો વિદુઃ ।  
સર્વકર્મફલત્યાગં પ્રાહુસ્ત્યાગં વિચક્ષણા: ॥૧૨॥

### શ્રી પીગુંાન ઓંજ

”કામ્યાનાં કર્મણાં, ન્યાસિર સન્યાસિર કોયો વડ્દ્ધ  
સર્વો કર્મભૂલત્યાગમ પ્રાહુસ્ત્યાગ વિચક્ષણા ॥ (૨)  
અરજન ! ક્યિત્રા ત્યે પંડત જન કામના વારા કર્મ ત્યાંગે કી  
સન્યાસ તા છુન આ ક્યિત્રા ત્યે વિચક્ષણ પ્રશ્ન સમ્પૂર્ણ કર્મ ક્લન  
જી ત્યાંગે કી ત્યાંગે છુન તા.

ત્યાજ્યં દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ ।

યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે ॥૧૩॥

”ત્યાજીજીર દોષો દિત્યીકી કર્મ પ્રાહુર્મનીષિણ્ણ  
યિગ્યે દાન ત્પણે કર્મ ને ત્યાજીમિત્યે ચાપરી ॥ (૩)  
ક્યિત્રાયે વડોન એનીન છુન તા તે સ્પી કર્મ દોષ સાન પીરિલ  
આહે, હાથી ત્યાંગે જી યોગ્યે આહે આ બ્યા વડોન એનીન છુન તા તે  
યિગ્યે, દાન આ ત્પ ત્યાંગે વાગ્બ ને આહે. અન ત્રખ એનીક મત બ્યાન  
કરી યોગીશુર પંહનગ્યો ત્યે નિશ્ચિકત મત ડ્યિન તા, રાયો ડ્યિન તા.  
નિશ્ચયં શૃણુ મે તત્ત્વ ત્યાગે ભરતસત્તમ।

ત્યાગો હિ પુરુષવ્યાઘ્ર ત્રિવિધ: સમ્પ્રકીર્તિત: ॥૧૪॥

”نِشَّاپِيَّو شِرِّطُومِي تَتِرَ تِياَّبِي پِرَقَسَسَتَمْ  
تِياَّغُو هِي پُرَشُو يَا گهْر تِرِوَدَه سِمِّيَّر كِير تَتَّه“ (٤)  
هي ارجن! اُن تِياَّبِه جِي بارِي ھُو تون منهنجو نِشَّاپِيَّه بُنْدُ.  
هي پُرُش سريشت! اهو تِياَّبِه ٿن پرڪارن جو چيو ويو آهي.

يَظِنَانَتَهْ: كَرْم نَتَهْ تَهْ تَهْ

يَظِنَ دَانَ تَهْ شَفَعَهْ پَافَنَانِي مَنَيِّشَلَامْ ١١٥١

”يَغِيَّه دَان تَهْ كَرْم نَهْ تِياَجِيَّمْ كَارِيَمِيَّه تَهْ  
يَغِيَّو دَانِيَّه تَهْ شَكَيَّيَّه پَافَنَانِي مَنَيِّشَلَامْ“ (٥)  
يَغِيَّه دَان ئَهْ تَهْ هي ٿن پرڪار جا كَرْم تِياَبِه لائق نه  
آهن، انهن کي ته ڪرڻ ئي گهرجي، چاڪاڻ ته يَغِيَّه، دَان ئَهْ  
تَهْ تَيَّيَّه ئي پُرُشون کي پوٽر ڪرڻ وارا آهن.

شري ڪرشٽ چار پرچلت مَنِّ جو الٰيکه (ورنن) ڪيو.  
پهريون وٽندڙ ڪرمن جو تِياَبِه، بي سمپورٽ ڪرمن جي ڦل جو  
تِياَبِه. ٿيون نقصان ئَه ڏوھن سان پيريل دوش هئٽ جي ڪري  
سڀني ڪرمن جو تِياَبِه ئَه چوٽون مَت هئو يَغِيَّه، دَان ئَهْ تَهْ  
هئٽ يَغِيَّه نه آهن اُنهن مان هڪ متى ھُو پنهنجي سهمتي پرگ  
هٽ ڪندي چيائون ته ارجن! منهنجو اهوي نشچت ڪيل متوا  
آهي ته يَغِيَّه، دَان تَهْ روپ ڪريا تِياَبِه واجب نه آهي. ان  
مان سِدِ آهي ته ڪرشٽ ڪال ھُو به ڪيترا ئي مَت هلندر ھئا،  
جن ھُو هڪ ڀتارت (صڪيچ ئَه سِڪپو) مَت هو. ان وقت ھُو به  
ڪيئي مَت هئا، اچ به آهن. جڏهن دنيا ھُو اچون ٿا، ته ڪيئي  
مَت متنانترن مان ڪلياڻڪاري مَت ڪڍي سامهون ڪڙا ڪري  
چڏي ٿو. هر هڪ مهاپرش ائين ئي ڪيو آهي، شري ڪرشٽ به  
ائين ڪيو، اُنهن ڪوئي نئون مارگه ڪونه ٻڌايو، بلڪ هلندر ڙ  
ڪيترن ئي مَتَن جي وچ ھُو ستيءه کي سمرڻن ڏيئي اُن کي

ઝાહર કીયો.

એતાન્યપિ તુ કર્માણિ સંહં ત્યક્તવા ફલાનિ ચ।  
કર્તવ્યાનીતિ મે પાર્થ નિશ્ચિતં મતમુત્તમમ्॥૬॥

”આનાનીધી તુ કર્માણિ સંહં ત્યક્તિ વા છલાનિ ચે  
કર તોયાનિતી મી પારઠ નિશ્ચક્તિ મટ્ટમુત્તમમ્ (૬)  
યોગીશુર શ્રી કૃષ્ણ જો ડીની જોન તા પારઠ! યીધી, દાન આ  
ત્પ-- રૂપી કર્મ આસ્ક્રી (મોહ) આનહેન જો ક્લ ત્યાંગી પ્રસ્તુર  
કર્ણ ગ્રહજન. એહોઈ મનેનું નશ્ચક્ત કીલ અત્મ મટ્ટ આહી.  
હાથી એજન જી સોાલ જી એનુસાર હો ત્યાંગે જો ચીડ કું તા.

નિયતસ્ય તુ સન્ધ્યાસ: કર્મણી નોપપદ્યતે।  
મોહત્તસ્ય પરિત્યાગસ્તામસ: પરિકીર્તિત:॥૭॥

”નીટસ્સિયે તુ સન્દીયા સ્ક્રમ કર્મટો નોપ્પ્રદ્યાત્યી  
મોહાત્સિયે પ્રિત્યા ગ્સ્તામસ્ક્રમ પ્રિક્રિયાત્યે“ (૭)  
હી એજન! નીત (મફર્ર) કર્મ (શ્રી કૃષ્ણ જી શબ્દન આ  
નીત કર્મ હુકે ઓઈ આહી, યીધી જી પ્રક્રિયા. હેન નીત શબ્દ કી  
એ ડ્ધે પીરા યોગીશુર ચીયો. હેન ત્યિ ઓર જો રૂર ડનો તે કુંતી સાદ્ક  
પિંકી બ્યો ને કર્ણ લેગી). હેન શાસ્ત્ર વડીએ સાન નર્દારત કર્મ  
જો ત્યાંગે કર્ણ વાજ્બ કુંન્હી. મોહ જી ક્રિ અનુ જો ત્યાંગે  
કર્ણ નામસ ત્યાંગે ચ્યું વ્યો આહી. સન્સારી વશીએ વસ્તો જી  
આસ્ક્રી આ કાસી કાર્ય કર્મ (કાર્ય કર્મ આ નીત કર્મ  
હુકે જા પૂરું આહે) જો ત્યાંગે નામસી આહી. એહ્રો પ્રેરણ  
”ાદાની લેક્ષ્ણી“ જી શત પત્નિએ બીન એદ્ર જોઢીન આ વજી ત્થો  
ચાકાણ તે હેન પ્રેરણ જી પ્રરૂતીન જો ત્યાંગે કીયો. હાથી રાજ્યસ  
ત્યાંગે જી બારી આ બ્દાએન તા.

દુઃખમિત્યેવ યત્કર્મ કાયકલોશભયાત્યજેત.  
સ કૃત્વા રાજસં ત્યાગં નैવ ત્યાગફલં લભેત॥૮॥

”دَكْمِتِيَّيُو يَتَكَرْمَ كَايَكَلِيهَشِيَّيَا تِيَّجِيَّيْت  
 سِكَرِتِوَا راجِسِيرَ تِيَاَغِيرَ تَعِيَّوَ تِيَاَغَقَلِيرَ لَيِّيَّت“ (٨)  
 ڪرم کي دکه میه سمجھئي شریر ک ڪليش جي ڊپ کان  
 انجو تياڳه ڪرڻ وارو ويڪتي راجس تياڳه کي ڪري به تياڳه  
 جي ڦل کي پراپت نٿو ٿئي. جنهن کان پچن پار نه لڳي ئه  
 ”ڪايا ڪليشِيَّتاتِ“ ان ڊپ کان ڪرم کي تياڳي ڇڏي ته  
 شرير کي ڪشت ٿيندو، اُن منش جو تياڳه راجس آهي. اُن کي  
 تياڳه جو ڦل پرم شانتي نٿي پراپت ٿئي ئه  
 کار्यमित્યેવ યત્કર્મ નિયતં ક્રિયતેજ્જુન।

سङ्घं त्यक्त्वा फलं चैव स त्यागः सात्त्विको मतः ॥१९॥

”ڪارِيَّمِتِيَّيُو يَتَكَرْمَ نِيَّتِيرَ ڪِرِيَّتِيرِ جُنْ  
 سَنَّيَّيرَ تِيَّكِتِوَا ڦَلِيرَ ڪَعِيَّيُوسَ تِيَاَغَهَ سَاتِوَمُو مَتَهَ“ (٩)  
 هي ارجن! ڪرڻ ڪرتويه آهي ائين سمجھئي جو نِيَّتِيرَ“  
 شاستر وڌيءَ سان نراڏارت ڪيل ڪرم سنگ دوش ئه ڦل کي تياڳه  
 ي ڪيو وڃي ٿو، اُهو ئي ساتوڪ تياڳه آهي. هاڻي مقرر ڪرم  
 ڪريون ئه ان ڪانسواء جو ڪجهه آهي، اُن جو تياڳه ڪري  
 ڇڏيون. هي نيت ڪرم ڇا ڪندائي رهندما يا ڪڏهن انجو  
 تياڳه ٿيندو؟ اُن تي چون ٿا (هاڻي انتم تياڳه جو روپ ڏسون)  
 ن ڏોષ્ટ્યકુશલં કર્મ કુશલે નાનુષ્ઞજતો।

त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशयः ॥१९०॥

”نَهِ دِوِيَشِتِيَّيُكَشَلِيرَ ڪَرَمَ ڪُشَلِيَ نَانُوُ شَجَاجِتِي  
 تِيَاَغِيَ سَتِوَسَمَا وِشَتُو مِيدَاوِي چَنَسَنَشِيَّهَ“ (١٠)  
 هي ارجن! جو پرش ”اُڪَشَلِيرَ ڪِرَم“ ارتقات  
 اڪلياڻكاري ڪرم سان (شاستر نِيَّتِ ڪرم ئي ڪلياڻكاري  
 آهن. ان جي وروڏ ۽ جو ڪجهه آهي، هن لوڪ جو بندن

આહી અન કરી એકલિાટ્કારી આહી, એહેં ક્રમન કર્મન સાન ) દોયિશ નંત્રો કરી એ કલિાટ્કારી ક્રમ હ્ર આસ્કટ નંત્રો ત્થેયી, જિકી કર્ણો હો હું હો બે બાચી ને રહ્યો આહી. એહેં સેજ સાન મલીલ પ્રશ્ન શક બના, ગીયાનોન એ ત્યાંગી આહી. હેં સ્પી કંજ્યે ત્યાંગ્યો આહી, પર પ્રાપ્તિ એ સાન ગ્રદ્ધ પૂર્વે ત્યાંગે ઓં સન્યાસ આહી. ત્યી સ્ગેહિઠો પ્રિય કુ સ્રુલ રસ્તો હગ્યી? અન ત્યી ચુંણ તા ને! ડ્સોન.

ન હિ દેહભૂતા શક્વયં ત્વક્તું કર્માણ્યશેષતઃ।  
યસ્તુ કર્મફલત્યાગી સ ત્યાગીત્યભિધીયતે॥૧૧॥

”ને હી દિયેપ્રતા શક્યેમ ત્યેક્તેમ કર્માણ્યશેષતઃ  
યેસ્તો કર્માણ્યાંગી સ ત્યાગીત્યિપ્તાંપ્તિ (૧૧)

દિયે ઢારી પ્રશ્ન દોવારાન (ચર્ચ શ્રીર ઓં ને, જન્હન્કી તોહીન ડ્સો તા. શ્રી કર્ષ્ણ જી અનોસાર, પ્રકૃતી કાન એપન સેટો, રાજ, ત્રીજી ગ્રન્થ ઓં હેં જ્યો આત્મા કી શ્રીરેન હ્ર બ્ર્ડન તા. જિસ્તાનીન ્ગ્રન્થ જીન્ના આહેં તિસ્તાનીન હો જ્યો ઢારી આહી. કન્હને ને કન્હને રૂપ હ્ર શ્રીર બદલગ્ન ત્યિન્દા રહેન્દા. દિયે જી કાર્ણ જિસ્તાનીન જ્યોત આહી) સ્મીપૂર્ણતા સાન સ્પીન્યે કર્મન જો ત્યાંગ મુક્ન ને આહી, તન્હેન્કરી જો પ્રશ્ન ક્રમ જી ક્લ જો ત્યાંગી આહી, હું હો ત્યાંગી આહી - એનીન જ્યો વજી ત્વો હાથી જિસ્તાનીન શ્રીર જી કાર્ણ જીન્નરો આહી, તિસ્તાનીન નીચત ક્રમ ક્રીયન એ અં જી ક્લ જી ત્યાંગે ક્રીયન. બદલી હ્ર કન્હને ક્લ જી કામના ને ક્રીયન. એનીન તે સ્કામી પ્રશ્ન જી કર્મન જો ક્લ બે ત્યિન્દો આહી.

અનિષ્ટમિષ્ટ મિશ્રં ચ ત્રિવિધં કર્મણः ફલમ्।  
ભવત્યત્યાગિનાં પ્રેત્ય ન તુ સન્યાસિનાં ક્વચિત्॥૧૨॥

”اُنْشَتَهِ شَتَّى مَشَرَّدٍ چَهَ قَرِوَّدَمَ كَرَمَلَهَ ڦَلَّى  
پَوَّتِيَتِيَا گِينَا ۾ پِريٽيَه نَه تُوْسَنِيَا سِنا ڪَوَچَت“ (۱۲)  
سکامي پُرشن جي ڪرم من جا سناء، بُرا ۽ مليل-اهزو ٿن  
پرڪارن جو ڦل مرت ڪانپوء به ٿيندو آهي، جنم جنمانترن  
تائين ملي ٿو پر ”سَنِيَا سِنَام“ سڀ جو انت ڪرڻ وارا پورڻ  
تياڳي پُرشن جي ڪرم من جو ڦل ڪنهن به ڪال ۾ نتو ٿئي. اهو  
ئي شد سنیاس آهي چرموتِکرشت اوستا آهي. پلي بُري ڪرم من  
جو ڦل ۽ پورڻ انت ڪال ۾ اُنهن جي انت جو سوال پورو ٿيو.  
هاڻي پُرش جي دواران شڀ يا اشڀ ڪرم ٿيڻ ۾ ڪھڙو ڪارڻ  
آهي؟ ان تي ڏسوں.-

پشٰءٰ تانيٰ مہاباہو کارणانی نیبودھ مے।

سادھٰئے کُوتا نتے پروڪٰنا نی سِدھو ڻي سارِ کارمَانَمٌ ۱۹۳۱۱

”پَنَچَئِيَتِي مَهَابَاهُو ڪَارِڻاَنِي نِبُوَّدَمِي  
سانکيبي ڪرتانِتي پروڪٰنانِي سِدَّيِي سَرَوَ ڪَرِمَانَم“ (۱۳)  
هي مهاباہو! سڀني ڪرم من جي سِدَّي ۽ لاء پنج ڪارڻ سانکيه  
سد انت ۾ چيا ويا آهن، اُنهن کي تون مونکان چڱي ۽ طرح  
ڄاڻ.

اَدِيشِانَمَ تَهَا كَرَتَا كَرَّهَ چَهَ پِرَقَيَوَدَمَ

”اَدِيشِانَمَ پِرَقَيَهِ شَتَا دَئَيِّوَهُمَ چَئِيَوَا تَرَ پِنَچَمَهُ ۾“ (۱۴)

هن وشهي ۾ ڪرتا (هي ۽ من) آهستي آهستي ڪرڻ (جنهن  
جي دواران ڪيو وڃي ٿو. جيڪڏهن شڀ پار لڳي ٿو ته وويڪ  
ويراڳ، شِمر دَمَ تياڳه، سديو چنتن جون پروٽيون وغيرة  
ڪرڻ ٿينديون. جيڪڏهن اشڀ پار ٿو لڳي ته ڪام، ڪرود،

રાબ્દ, દોવિશ, ટકી કામના, લોપ વગ્ભર કર્ણ તીવિના. અનેન  
જી દોવારાન પ્રેરિત તીવિના) ગહેઠન ક્ષમન જોન નીયારિયોન  
ચીયિશ્ટાઈઓન (અન્ને એ જોન) આડાર (અર્થાત સાડાન, જનેન એ જા  
જી સાથ સાન સાડાન મલ્લિયો આહાઈ પૂર્યિ તીયે લેખી તી) આ  
પંખજુન કાર્ણ આહી દ્યો યા સંસ્કાર, હેન જી પશ્ટી કેન તા.

શરીરવાઙ્મનોભિર્યત્કર્મ પ્રારભતે નરઃ।

ન્યાય્યં વા વિપરીતં વા પશ્ચૈતે તસ્ય હેતવઃ॥૧૫॥

”શ્રીર વાંગમનો પ્રેર યેતક્રમ પ્રાર પૈંત્ય નરહ

નીયાયીર વા વિપ્રેર વા પંદ્રક્ષેપિત્ય ત્સિયે હીતોહ ” (૧૫)  
મન્શ મન, વાંગી આ શ્રીર સાન શાસ્ત્ર અનોસાર યા અબ્દી કજ્ઞ  
ક્રમ શરૂઆત કરી ત્થો, અંગા આહી તી પંજ કાર્ણ આહેન. પ્ર  
અનીન તીયે તી બે-

તત્ત્વૈવ સતિ કર્તારમાત્માન કેવલં તુ યઃ।

પશ્યત્યકૃતબુદ્ધિત્વાત્ત્ર સ પશ્યતિ દુર્મતિ:॥૧૬॥

”તત્ત્રી રીયોહ સેત હરતારમાત્માન ક્યોલી ત્વોયઃ

પ્રેશિયેત્યિકર તબ્દીયતોનન્ત સ પ્રેશિયેત્યિદ્રમન્થે ” (૧૬)

જો પ્રેશ અશ્ચ બ્ર્દ્યી આ કાર્ણ અન વશી લી ક્યોલિયે સ્રોપ  
આત્મા કી કરતા ડસી ત્થો, આહો દુર્બ્ર્દ્યી યીતારથ નત્તો ડસી અર્થાત  
પ્રેગુાન નત્તો કરી.

અન સોાલ તી યોગીશુર શ્રી કર્શ્ણ બ્યા પ્રેરો ઝૂર ડનો. અડિયા  
પંખજીન લી હેન ચ્યા હો તે આહો પ્રેરો ને કરી ત્થો ને કરાઈ ત્થો,  
ને કરીયા જી મિલાપ કી જોર્યી ત્થો. તે માઠ્યો જોન ચો તા? મોહે  
સાન માઠ્યેન જી બ્ર્દ્યી ડિકિલ આહી, તનહેન કરી કજ્ઞ બે ચેંચી  
સ્ગેન તા. હતી બે ચ્યા તા. ક્રમ તીયે લી પંજ કાર્ણ આહેન.  
અન જી બાંજુદ બે ચો કેન્યોલિયે સ્રોપ પ્રમાત્મા કી કરતાડસી

ٿو، اُهو موڙهه بُڌي (دُرِبُڌي) يئارت نتو ڏسي ارتات پڳوان نتو ڪري، جڏهن ته ارجن لاء هو تال ٺوکي ٺوکي ڪڙو ٿي وڃن ٿا، ”نِيمِتماتِرِم پَو“ ته ڪرتا ڏرتا ته مان آهيابن تو نمت بُطجي ڪڙو ٿي وچ. آخر هو مهاپرش چوڻ چا ٿا چاهين؟ حقiqet ۾ پڳوان ۽ پرڪريٰ جي وچ ۾ هڪ آڪرشن ريكا آهي. جيسـتـائـينـ سـادـڪـ پـرـڪـريـ جـي ۾ حـدـ آـهـيـ، پـڳـوانـ نـتوـ ڪـريـ. تمام ويـجـهوـ رـهـنـديـ بهـ درـشـتاـ روـپـ ۾ ئـيـ رـهـنـ ٿـاـ. آـنـيـهـ پـاـوـ سـانـ اـشـتـ کـيـ پـڪـڙـ ٿـيـ هوـ هـرـدـيهـ دـيـشـ ۾ سـنـچـالـڪـ (هـلـائـيـندـڙـ) بـطـجيـ وـجـنـ ٿـاـ. سـادـڪـ پـرـڪـريـ جـيـ آـڪـرـشـنـ جـيـ حـدـ مـانـ نـكـريـ هـنـجـيـ کـيـتـرـ ۾ اـچـيـ ٿـوـ وـجـيـ. اـهـڙـيـ انـورـاـگـيـ جـيـ لـاءـ هوـ هـتـ ٺـوـکـيـ سـداـئـينـ ڪـڙـاـ رـهـنـ ٿـاـ. فقطـ اـُـنـ لـاءـ پـڳـوانـ ڪـنـ ٿـاـ. هـاـڻـيـ چـنـتنـ ڪـرـيوـ. سـوالـ پـورـوـ ٿـيوـ. اـڳـيانـ ڏـسـونـ.

يـسـيـمـ نـاـهـڏـڪـوتـوـ بـاـڪـوـ بـुـدـ્دـيـرـسـيـ نـ لـيـધـيـتـاـ।

هـتـવـاـپـيـ سـ إـمـاـنـلـلوـكـوـ كـاـنـنـ هـنـتـيـ نـ بـيـدـيـتـيـ 17||

”يـسـيـمـ فـاـهـڻـڪـرـ تـوـ ڀـاوـوـ ٻـڏـيـرـ يـسـيـمـ نـ لـيـتـيـ هـتـنـواـپـيـ سـ إـمـاـنـلـلوـكـوـ كـاـنـنـ هـنـتـيـ نـ بـيـدـيـتـيـ“ (17) جـنـهـنـ پـرـشـ جـيـ اـنـتـهـڪـرـ ۾ ”مانـ ڪـرـيـانـ ٿـوـ“ اـهـڙـوـ پـاـوـ نـ آـهـيـ ۽ جـنـهـنـ جـيـ بـڏـيـ لـپـائـمانـ نـتـيـ ٿـئـيـ، اـهـوـ پـرـشـ إـنـهـنـ سـپـنـيـ مـاـڻـهـنـ کـيـ مـارـينـدـيـ بهـ سـچـ پـچـ نـ تـهـ مـرـيـ ٿـوـ ۽ نـ ٻـڏـجيـ ٿـوـ. لوـڪـ. سـبـنـدـڻـيـ سـنـسـڪـارـنـ جـوـ وـليـ، لـينـ ٿـيـڻـ ئـيـ لوـڪـ سـنـهـارـ (مارـڻـ) آـهـيـ. هـاـڻـيـ نـيـتـ ڪـرمـ کـيـ اـتسـاـهـ ڪـيـئـ ٿـوـ ٿـئـيـ؟ اـنـ تـيـ ڏـسـونـ.

जـानـ जـे~य~ पـर~ज~ात~ा त्रि~वि~ध~ा क~र~म~च~ो~द~न~ा।

कـरـणـ कـरـمـ कـरـ्तـैـतـिـ त्रि~वि~ध~ः कـर~म~स~ङ~ग~्र~ह~ः 18||

”گـيـاـنـ گـيـيـيـ ۾ پـرـ گـيـاـتـاـ تـرـوـدـاـ ڪـرـمـچـوـدـنـاـ ڪـرـئـيـ ڪـرـمـ ڪـرـمـ ڪـرـ تـيـتـيـ تـرـوـدـهـ ڪـرـمـسـنـگـرـ هـهـ“ (18)

ارجن ! پریگیاتا ارتقات پورٹ گیاتا مهاپرش کان "گ  
یان" انکی چائٹن جی وڈی سان ئے "گیبیج" چائٹن یوگیہ  
وستو (شري ڪرشن پنیان چيو ته مان ئی چائٹن یوگیہ پدارت  
آهیان) سان ڪرم ڪرڻ جو اُتساھ ملی ٿو. پھرین ته پورٹ  
گیاتا کو مهاپرش هجی، اُن جی دواران اُن گیان کی چائٹن  
جی وڈی پراپت ٿئی، لکشیم- گیبیم تی درشتی هجی  
تذهن ڪرم جو اُتساھ ملی ٿو ئے ڪرتا (من جی لگن)، ڪرڻ  
(وویک، ویرا پگ، شم، دم وغیرہ) تنهن ڪری ڪرم جی  
جانکاري سان ڪرم ڪنا ٿیندا آهن، ڪرم گڏ ٿیڻ لڳن  
ٿا. اگیان چیو ویو هو ته پراپتی ئے کان پوءِ ان پرش جو  
ڪرمن ڪرڻ سان کو پریوجن نٺو رهی ئے نه ڇڏن سان ڪا  
هاجی ٿئی ٿی، پوءِ به لوک سنگره ارتقات پنیان رهیل -  
منشن جی هردیه ۾ ڪلیاٹکاری سادنن گڏ ٿیڻ لاءِ هو ڪرم  
۽ ورتی ٿو. ڪرتا، ڪرڻ ئے ڪرم جی دواران انھن جو  
سنگره ٿئی ٿو. گیان، ڪرم ئے ڪرتا جا به ٿي - ٿي پید  
آهن -

ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः।  
प्रोच्यते गुणसङ्ख्याने यथावच्छृणु तान्यपि॥१९॥

"گیان ڪرم چه ڪرتا چه تروئید و گُنپید تَه  
پرو چیتی گُنپند کیان یتاؤ چرڻو تانیپی " (۱۹)  
گیان ڪرم ئے ڪرتا به گلن جی پید سان سانکی شاستر ۾  
ٿي - ٿي پید پرکارن جا چیا ویا آهن، انھن کی به تون سچائیءَ  
سان پُنڈ. پرستت آهن پھرین گیان جا پید.

सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते।

अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम्॥२०॥

"سرو پُو ٿیشو یئنئیک یا و م او یئیمیک شتی

آو پِيَكتِير وِ يِكتِير وِ يِكتِيشُو تَجِيَانَير وِ دِي سَاتِوكِير (۲۰)  
 ارجن ! جنهن گيان سان منش آهستي آهستي سيني  
 پوتون هك اوناشي پرماتما پا و کي و پا گ رهت هك رس  
 ڏسي ٿو، اُن گيان کي تون ساتوک چاڻ. گيان ظاهر انوپيوٽي  
 آهي، جنهن سان گڏ ئي گظن جي انت ٿيڻو آهي. هيء گيان  
 جي پکي تيار ٿيل اوستا آهي. هاڻي راجس گيان ڏسون.

پُرثکٽونه تُو ڀِجْنَانَ نَانَابَهَادَارَانَ

وَنَانَابَهَادَارَانَ

"پِر ٿِكتِيوٽي تُو يِجِيَانَمِير نَانَابَهَادَارَانَ پِر ٿِكتِيوٽي  
 ويٽي سر ويٽي پِر ٿِكتِيوٽي تُو يِجِيَانَمِير راجسِير" (۲۱)  
 جو گيان سمپورڻ پوتون هر الڳ پرڪار جي انيڪ ڀاون کي  
 الڳ الڳ ڪري ڄاڻي ٿو ته هي سنو آهي، هي بُرا آهن. اُن  
 گيان کي تون راجس چاڻ. اهڙي استتي آهي، ته راجس سطح  
 تي تنهنجو گيان آهي. هاڻي ڏسون تامس گيان.

يَنْتَهِيَ الْمُعْذِلَةُ وَيَنْتَهِيَ الْمُؤْمِنُ

أَتَتَّهْلِكَةُ الْمُؤْمِنِ وَأَتَتَّهْلِكَةُ الْمُكَفَّرِ

"يَتُو ڪِر تِسِنَود يِڪِسِمِنِڪارِي يِسِڪِتَمَهَئِي تُكِير  
 آقِتِوارِ ٿَوَ دِ لِپِير چِ تَنَامَسِمَدَا هِرِ تِير" (۲۲)  
 جو گيان فقط ايڪ ماتر شرير هر ئي سمپورتا سان ساڳئي  
 نموني آسكت آهي، ڪنهن به يٽي کانسواء ارتات جنهن  
 جي پنهيان ڪا ڪر يا نه آهي، تتو جي ارت سروپ پرماتما جي  
 چاڻ کان الڳ ڪرڻ وارو آهي، اهو گيان تامسي چيو وڃي ٿو.  
 هاڻي بدائين ٿا ڪرم جا ٿي پيد.

نِيَّاتِ سَاحِرِ رَحِيمِ دُوَسَّهَاتِ: كُرْتَمَ

أَفْلَامَ بَرَسَّنَا كَرْمَ يَنْتَهِيَ الْمُؤْمِنُ

”નિર્ણય સંગ્રહેતેમા ગ્રદ વિશ્વાસ કરતું  
આચલીપર પીસુના કરમ યિત્તસા તુ કુમ્ભકિતી “ (૨૩)  
જો કરમ ”નિર્ણય “ શાસ્ત્ર ઓદ્યો સાન નર્દારત આહી (બિંબ  
ને), સંગ દોશ એ ક્લે કી ને ચાહેટ વારી પ્રશ દોવારાન બના રાગે  
ડોયિશ જી ક્યા વ્જન છા, અહી કરમ સાતોક ચ્યા વ્જન છા. (નિર્ણય  
કરમ આરાધના) ચંનન આહી, જો પ્રમ ઝ પ્રોયિશ ડ્યારી તુ.

યત્તુ કામેસ્થુના કર્મ સાહ્યક્રૈણ વા પુનઃ ।  
ક્રિયતે બહુલાયાસં તદ્રાજસમુદાહતમ् ॥૨૪॥

”યત્તો કામીપીસુના કરમ સાહનકારીથ વાપ્નાસ  
કરીયતી બહુ લાયાસી તદ્રાજસ્મ્દા હેરતું “ (૨૪)  
જીક્યુ કરમ ઢાયિ મહન્ત સાન પ્રિય આહી, ક્લે કી ચાહેટ  
વારન એ અહન્કાર સાન મલીલ પ્રશ દોવારાન ક્યિ વ્જિ તુ, અહો કરમ  
રાજસ ચ્યા વ્જિ તુ. હ્યો પ્રશ બે અહીની નિર્ણય કરમ કરી તું  
પર ફ્રેક માત્ર એટ્રો આહી તે ક્લ જી એચા એ અહન્કાર સાન યિક્ત  
(પ્રિય) આહી તન્હેન કરી હેન જી દોવારાન ત્યેખ વારો કરમ રાજસ  
આહી. હાઠી ડ્સોન તામસ -

અનુબન્ધં ક્ષયં હિંસામનવેક્ષ્ય ચ પૌરુષમ् ।  
મોહાદારભ્યતે કર્મ યત્તત્તામસમુચ્યતે ॥૨૫॥

”અનુભન્ધ કશીય હિંસામનો યિક્ષિયે ચે પ્રેરૂર શર  
મોહાદાર પીણીય કરમ યિત્તના મસ્ચ્યિતી “ (૨૫)  
જો કરમ પ્રેરૂર એ આખ નશ્ટ ત્યેખ વારો આહી. હિંસા -  
સામર ત્યે જો ને વિચાર કરી ફ્રેક મોહે વિશ શ્રોય ક્યિ વ્જિ તુ,  
અહો કરમ તામસ ચ્યા વ્જિ તુ, ચાફ આહી, ઝાહર આહી તે હ્યો  
કરમ શાસ્ત્ર જો નિર્ણય (મફર) કરમ ને આહી. અન જી જેંઘ તી  
પ્રમ આહી. હાઠી ડ્સોન કરતા જા લક્ષ્ય -

مُڪْڪَسِنْگُو نَهْمِوادِي ڏرِتِيوُ تِسا هَسَمنِو تَهْ  
سِدَ يَسِدَّيو نِرو كَارَهَمَ كَرتَا ساتِوكَ أُچِيتِي ॥٢٦॥

”مِكَتَسِنْگُو نَهْمِوادِي ڏرِتِيوُ تِسا هَسَمنِو تَهْ  
سِدَ يَسِدَّيو نِرو كَارَهَمَ كَرتَا ساتِوكَ أُچِيتِي“ (۲۶)  
جو ڪرتاسنگ دوش کان رهت ٿي، اهنڪار جا وچن نه بولڻ  
وارو، ڏيرج ئهه سان پورڻ ٿي، ڪاريه جي سِدِ هئڻ ئهه نه  
هئڻ ۾ هرش (خوشي) شوڪ وغيرة وڪارن کان سڀ پاسي رهت  
ٿي ڪرم ۾ (رات ڏينهن) پرورت آهي، اُهو ڪرتا ساتِوكَ آهي.  
اهيئي اُتم سادڪ جا لکشٽ آهن، ڪرم اُهي ئي آهن. نِيت  
ڪرم.

راغي کرمفالپرمُلُبُدُو هِينِسَا تَهْ مُو شُچِڪَه  
هَرَ شَشُوكَانِو تَهْ كَرتَا راجَشَهَ پَرَكِيرَ تَهْ ॥٢٧॥

”راگي ڪرمقلپير يپسُورَ لَبَدَو هِينِسَا تَهْ مُو شُچِڪَه  
هَرَ شَشُوكَانِو تَهْ كَرتَا راجَشَهَ پَرَكِيرَ تَهْ“ (۲۷)  
آسكتيء سان پيريل، ڪرمن جي ڦل کي چاهڻ وارو، لوبي،  
آتمائين کي ڪشت ڏيڻ وارو، پوتر ۽ هرش شوڪ سان جو لپٽ  
آهي، اُهو ڪرتا راجس چيو وجي ٿو.

اعُوٰٹ: پراڪُوت: سٽٽُد: شَثَوْنَإِلْكُتِيكَوْلَس: ।

فيٰشَا دَيَّرْسَوْنَى چَ كَرْتَا تَامَسَ عَصَيَّتَهَ ॥٢٨॥

”آيِكتَهَ پَرَأِكَرَتَهَ سِتَبَدَهَ شَنُو نَعَيِشَ ڪِرَتِكَوَ لَسَهَمَ  
وشا دي ڏير گھسوٽري چه ڪرتا تامَسَ أُچِيتِي“ (۲۸)  
جيڪو چنِچل چت وارو، آسيپير، گھمندي، ڏوُرت، ٻين  
چي ڪمن ۾ رڪاوٽ وجهڻ وارو، شوڪ ڪرڻ جي سڀاء وارو،  
آلسي ئهه دلو آهي ته پوءِ ڪنداسين، اُهو ڪرتا تامَس چيو وجي  
ٿو. دلو پرش ڪرم کي بئي ڏينهن تي ٿارڻ وارو آهي،

જિતોઢિક કર્મ હી એ અન કી બે રહી છી. અન ત્રણ કરતા  
જા લક્ષ્ણ પૂરા છીએ. હાથી યોગીશુર શ્રી કૃષ્ણ નેંન સોલ  
આતારિઓ- બેદી, ડારથા આ સ્ક જા લક્ષ્ણ -

બુદ્ધેભેદં ધૃતેશૈવ ગુણતસ્ત્રિવિધં શૃણ।

પ્રોચ્યમાનમશેષેણ પૃથક્ત્વેન ધનભ્જય॥૧૨૯॥

"બેદી પ્રિય દરતિશચ્કીયો ગુણેત્રિયો દ્વાર શ્રીદ્વુ

પ્રો ચીમા ન્મશિશીયો પ્રથીકૃત્વીન દન્નજિમે (૨૯)

દન્નજિમે! બેદી આ ડારથા શક્તી જા બે ગ્રણ કારણ ત્ન પ્રકારન  
જા પ્રિય સમ્પૂર્ણતા સાન વિયાગે પૂરો મુન કાન બેદી.

પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ કાર્યકાર્યે ભયાભયે।

બન્ધ મોક્ષં ચ યા વેત્તિ બુદ્ધિઃ સા પાર્થ સાત્ત્વિકી॥૧૩૦॥

"પ્રારૂપ ચે નૂરૂપ ચે કાર્યિ પ્રિયાયી

બન્દુર મોક્ષ ચે યા વિત્તી બેદીયે સા પારથ સાતોકુર (૩૦)

પારથ ! પ્રારૂપ નૂરૂપ કી કૃત્વીયે એ એકરૂપીયે કી યેદી એ  
નીરીયે એ બન્દન એ મોક્ષ કી જા બેદી યતારથ મિયી છી, જાથી  
છી, આ હા બેદી સાતોકી આહી. એરાત પ્રમાત્મા - પેટ, આવાગ્મન -  
પેટ બન્દહી જી ચેંગી એ ત્રણ જાણ સાતોકી બેદી આહી.  
ટન્હેન્કરી -

યયા ધર્મમધર્મ ચ કાર્ય ચાકાર્યમેવ ચા।

અયથાવત્પ્રજાનાતિ બુદ્ધિઃ સા પાર્થ રાજસી॥૧૩૧॥

"યીબા દરમ્મદરમ્મ ચે કાર્યિર ચાકાર્યમ્મિયો ચે

આયા વિપ્રજાના ત્યે બેદીયે સા પારથ રાજસી " (૩૧)

પારથ ! જન્હેન બેદી દોવારાન મન્શ દરમ એ એડરમ કી એ કૃત્વીયે  
એ એકરૂપીયે કી બે પૂરો ન્ત્વો જાથી, ક્રણ લાંચ ન્ત્વો જાથી, એડૂરો  
જાથી છો, આ બેદી રાજસી આહી. હાથી તામસી બેદી એ જો

سرور پ ڏسون -

અર્થમાં ધર્મમિતિ યા મન્યતે તમસાવૃત્તા।  
સર્વાર્થાન્વિપરીતાંશુ બુદ્ધિ: સા પાર્થ તામસી॥૩૨॥

”ાડરમ દરમેમિતી યા મનીની તેમસા વરતા  
સર્વાર તાનો પ્રીતા નશ્ક્રમ બુદ્ધિમ સા પારથ તામસી (૩૨)“  
પારથ ! તમો ગુણ સાન ડિકિલ જા બુદ્ધિ આડરમ કી ડરમ મજી  
થી આ સમ્પૂર્ણ પાલિન કી અબુનો થી દસી થી, આ બુદ્ધિ તામસી  
આહી.

હતી શલોકન તીહન કાન બ્ટિહન તાનીન બુદ્ધિએ જા થી પિદ  
બ્દાયા વિયા.

પહ્રેનીન બુદ્ધિ કી કન્હેન કારિય કાન નુરત થિયો આહી આ  
કન્હેન હી પ્રોરત થિયો આહી, કહેરો કરતોબે આહી આ કહેરો  
એકરતોબે આહી, અન જી ચ્ક્રી ત્રણ જાણ રકી થી આ બુદ્ધિ સાતોકી  
આહી. જિકા કરતોબે - એકરતોબે કી દોન્હા તીલ દિન્હ સાન જાણી  
થી, સ્ક્રીન થી જાણી, આ રાજસી બુદ્ધિ આ એડરમ કી ડરમ, નાસ  
થિયે વારિ કી કાંઈ પલી કી બરો, અન પ્રકાર જી અબી જાણ  
વારિ બુદ્ધિ તામસી આહી. અન ત્રણ બુદ્ધિએ જા પિદ - હાણી પ્રસ્તુત  
આહી બ્યો સ્વાલ ”દરિયી“ દારાણ જા થી પિદ -

ધૂત્યા યથા ધારયતે મન:પ્રાણેન્દ્રિયક્રિયા:।  
યોગેનાન્યભિચારિણ્યા ધૂતિ: સા પાર્થ સાત્ત્વિકી॥૩૩॥

”દરિયા યીયા દારાયિતી મન્દ્ખીપ્રા થીન્ડર યીકરિયાહે  
યોગીના ઓચિપારાણીયા દરિયા દરિયા દરિયા દરિયા દરિયા (૩૩)  
”યોગીન“ - યોગી પ્રકારિયા જી દોરાન ”ઓચિપારાણી“  
યોગે ચંનન કાનસોણ બેની કન્હેન ખ્યાલ, ઑની જો એચ્છ ઓચિપાર  
આહી, ચેત જો બહ્કી ઓચિપાર આહી; હાણી આહ્રી ઓચિપારાણી

ડારાટા સાન મનુષ મન, પ્રાણ આ એન્ડ્રિન જી ક્રિયા કી હો ડારાણ  
ક્રિ તો, આ ડારાટા સાતોકી આહી. એર્થાત મન, પ્રાણ આ  
એન્ડ્રિન કી એષ્ટ જી ત્રફ મોર્ઝ ઊં સાતોકી ડારાટા આહી -  
તીવીન -

યયા તુ ધર્મકામાર્થાન્ધૃત્યા ધારયતેજુન।

પ્રસંગેન ફલાકાઙ્ક્ષી ધૃતિ: સા પાર્થ રાજસી॥૩૪॥

”યિયા તુ દર્મકામાર તાન્દિર ત્યા ડાર યેટિર જુન

પ્ર સન્ગીન છાલકાંકિશી દર્તખે સા પાર્થ રાજસી (૩૪)  
હી પાર્થ ક્લ જી એચા વારો મનુષ ઢાયિ આસ્ક્રી સાન જન્હન  
ડારાટા જી દોવારાન ફચ્ત દરમ, એર્થ કામ કી ડારાણ ક્રિ તો  
(મોક્ષ જી ના), આ ડારાટા રાજસી આહી. હેન ડારાટા હી બે લક્ષીય  
આંહો ઊં આહી, ફચ્ત કામના ક્રિ તો. જીક્યુ કંગ્રે ક્રિ તો અન  
જી બદ્લી હી ચાહી તો.  
હાઠી તામ્સી ડારાટા જા લક્ષીય દ્સુન.

યયા સ્વપ્ન ભય શોક વિષાદ મદમેવ ચ।

ન વિમુશ્ચતિ દુર્મેધા ધૃતિ: સા પાર્થ તામસી॥૩૫॥

”યિયા સ્વોપ્નિર યીન્ શોક્ઝ વિશાળ મદમ્યો ચ

ને મુન્જિત્તિ દુર્મિદા દર્તખે સા પાર્થ તામ્સી (૩૫)  
હી પાર્થ ! દુષ્ટ બુદ્ધી વારો મનુષ જન્હન ડારાટા જી દોવારાન  
નંદ, દ્પ, ચંતા, દક્ષ એ એયાન કી (નંતો ચુદ્ધી એનુસીની કી)  
ડારાણ ક્રિ રહી તો. આ ડારાટા તામ્સી આહી. હી સુઓ પૂરો  
તીયો. બ્યો સુઓ આહી સ્કુન્.

સુખં ત્વિદાનં ત્રિવિધં શૃણુ મે ભરતર્ષભ।

અભ્યાસાદ્રમતે યત્ત્ર દુઃખાનં ચ નિગચ્છતિ॥૩૬॥

”સ્વીકુર ત્વોદાન્યિર ત્રિર્વ્દીર શ્રીર્થુ મી યેર્તર શ્વી

آپیاسا دَرَمَتِی یَتَّرَ دُکانِتَّرَ چَهَ نِگَچَتِی (۳۶)  
 ارجن ! هاطی سکه به تن پرکارن جو مونکان بُد. اُنهن  
 مان جنهن سکه ۾ سادڪ اپیاس ۾ رَمْطُ ڪري تو ارتقات چت  
 کي سمیتی اشت ۾ رَمْطُ ڪري تو جو دکن جو انت ڪرڻ  
 وارو آهي. تنهنڪري -

يَتَّرَ دُکانِتَّرَ چَهَ نِگَچَتِی  
 تَسْعَخَنْ سَادِكَمَامَبِرَ سَادِجَمَامَبِرَ ۱۳۹۱

”يَتَّرَ دُگَرِي وَشِمَوَ پَرِيَطَا مِيمِيرَ تو پَمَمِيرَ  
 تَسْعَخَنْ سَادِكَمَامَبِرَ پَرِوكَتَمَا تَمِبَدِي پَرِسَادِجَمَامَبِرَ (۳۷)  
 مٿئين سکه سادن جي شروعات جي وقت ۾ جيڪڏهن زهر  
 جھڙو لڳندو هجي (پر هlad کي سوريءٰ تي چاڙهيyo وبو، ميرا  
 کي زهر مليو. ڪبير چوي تو -  
 ”سُکِيَا سَبَ سَنَسَارَ هَئِي، کَاوِي اُورَ سَوَوِي ا دُکِيَا دَاسَ ڪَبِيرَ  
 هَئِي، جَاهِي اُورَ روَوِي“ ته هاطی زهر جھڙو ڀاسي ٿو، پر قل ۾  
 امرت سمان آهي، امرت تَتَوَ کي ڏيارڻ وارو آهي. هاطی آتم  
 وشِيڪ پُڏيءَ جي پرساد مان اُتپن تيل سکه ساتوڪ چيو ويو  
 آهي. تيئن ...

وَشِيَيِنِدرَ يَسِنِيُو گَادِيَتَّرَ دُگَرِي مِرِتوَيِمَمِيرَ  
 پَرِڪَامِي وَشِمَوَ تَسْعَخَنْ رَاجِسِيرَ سِمِيرَ تَمَامَ ۱۳۸۱

”وَشِيَيِنِدرَ يَسِنِيُو گَادِيَتَّرَ دُگَرِي مِرِتوَيِمَمِيرَ  
 پَرِڪَامِي وَشِمَوَ تَسْعَخَنْ رَاجِسِيرَ سِمِيرَ تَمَامَ (۳۸)  
 جيڪو سکه وشيهءَ اندرین جي ميلاپ سان ٿئي ٿو، هـ ۱۴۰۰ هو  
 جيتوڻيڪ ڀوڳڻ وقت امرت سمان لڳي ٿو، پر قل ۾ زهر سمان  
 آهي، چاكاڻ ته جنم مرتيyo جو ڪارڻ آهي. هيءَ سکه راجسي  
 چيو ويو آهي. ئـ

યદગે ચાનુબન્ધે ચ સુરખે મોહનમાત્મનઃ।

નિદ્રાલસ્યપ્રમાદોત્થ તત્ત્વામસમુદાહૃતમ्॥૩૯॥

”યેદ્ગરિ ચાનુબન્ધી ચે સ્ક્રિમ મોહનમાત્મનઃ  
નદ્રાસીપ્ર માદોત્થી તત્ત્વમ્ભુતી હેરતી“ (૩૯)

જો સ્ક્રીમ પોગે કાલ એ ક્લે હો બે આત્મા કી મોહ હો વજ્હેઠ વારો આહી. નંદ ”યાનિશાસ્રોપ્યુત્તાનાં“ - જેગેત જી રાત હો બિહોશ કરું વારો આહી, આલ્સ એ એજાયોન ચીષ્ટાની સાન અંતિન તીલ હી સ્ક્રીમ તામસ ચ્યાં વ્યાં આહી.

હાઠી યોગીશુર શ્રી કર્શ્ણ ગુણ જી પ્રેર્ણ બ્દાએન તા, જી સ્પી કન્હેન જી પણીન લેગા પ્રિયા આહે -

ન તદસ્તિ પૃથિવ્યાં વા દિવિ દેવેષુ વા પુનઃ।

સત્ત્વં પ્રકૃતિજૈર્મુક્ત યદેભિ: સ્યાત્ત્ત્રિભિર્ગુણૈ॥૪૦॥

”ને ત્રદિસ્ત્યે પ્રત્યોભાર વાદ્ય દ્યોભિશ્ચો વાંનઃ  
સ્ત્નોમ પરિકૃતિભ્યાં મુક્તિર યે દ્યોભમ સ્વિયાત્રિત્રિપ્રિયે ગુણીનઃ  
(૪૦)

અરજન! પ્રત્યો હો, સ્રાગે હો યા દિયોતાની હો હત્રો કોઈ બે પ્રાણી ને આહી, જો પ્રકૃતી માન અંતિન તીલ તન ગુણ કાન રહેત હેણી. એરાત બ્રહ્મા કાન વ્યો કીટ, પણ્ણ યા વન્માત્ર જેગેત કુણ પિંગર, મ્રુણ-જીણ વારો આહી તન્હી ગુણ જી એન્ટરગ્રેટ આહી એરાત દિયોતા બે તન્હી ગુણ જી એન્ટરગ્રેટ આહી એરાત દિયોતા બે તન્હી ગુણ જા વ્યકાર આહે, નાસુંત આહે.

હેણી બાહ્રીન દિયોતાની કી યોગીશુર ચોઠ્ઠોન પ્રિયો આનદો આહી. એડ્યાં સ્ટોન, નાઈન, સ્ટ્રેહોન એ હેણી ઓર્જીનીન એડ્યાં હો. એન સ્પી જો હુક એ એર આહી તે દિયોતાની તન ગુણ જી એન્ટરગ્રેટ આહે. જીકુ અન્હેન જો પ્રેગન કરી શ્વો નાસ શીખ વારી જી પ્રોજા શ્વો

ڪري.

يا ڳوت جي بئي سکند ۾ مهرشي سکديو ۽ پريڪشت جو مشهور وياکيان آهي. جنهن ۾ اُپديش ڏيندي هو چون ٿا ته استري پرش ۾ پريم جي لاءِ شنڪر-پاروتي جي، صڪت لاءِ اشوني ڪمارن جي، سوپ لاءِ، اندر جي ۽ ڏن جي لاءِ ڪبير جي پوجا ڪريو. ان طرح جدا ڪامنائن جو ذڪر ڪري انت ۾ ٻڌائيں ٿا ۽ نرنئ ڏين ٿا ته سمپورڻ ڪامنائن جي پوري ۽ موڪش جي لاءِ فقط هڪ نارائڻ جي پوجا ڪرڻ گهرجي. ”تلسي مولهن سينچئي ڦولئه ڦلئي اگھائي.“ ائين سروپاپ پريو ڇو سمرڻ ڪريو، جنهنجي پوري ۽ لاءِ ستگرو جي شرڻ، نشكپت يا و سان سوال ۽ شيوا هڪ ماتر اڀاءً آهي

آسري دئوي سمپد انتهڪرڻ جون به ورتيون آهن. جنهن ۾ دئوي سمپد پرم ديو پرماتما جو دويه درشن ڪرائي ٿي. ان ڪري دئوي چئي وڃي تي، پر اها به ٿن گڻ جي انترگت ئي آهي. گڻ شانت ٿيڻ کانپوء انهن جي به شانتي ٿي وڃي ٿي. تنهن کان پوء ان آتم ترپت يوگي جي لاءِ ڪوبه ڪرتويه باقي نتو رهي. هاڻي پرسٽت آهي پنيان کان شروع ٿيل ورڻ- ويوسٽا. ورڻ جنم پرداان آهي يا ڪرمن سان پائڻ واري انتهڪرڻ جي يوگيتا جو نالو آهي؟ اُن تي ڏسون  
brahma-kshatriya-vishan shudra-an ch parantap.

کरماणی پ्रવی�ک्तानि स्वभावप्रभवैर्गुणैः ॥४१॥

”براهمناڪشتيريوشا ۾ شودرا ۽ چه پرنتپ ڪرمائڻي پڙوپيڪناڻي سو پا و پڙپوئير گئييه“ (۴۱) هي پرنتپ! برهمڻ، کتري، وئش ۽ شودرن جا ڪم سڀاً کان اُپن گڻ دواران ورهايا ويا آهن. سڀاً ۾ ساتو ڪ گڻ هوندا

تم توها ان ھر نرملتا هوندي، ڈيان - سماڌيءَ جي سمرٿي هوندي. تامسي گٽ هوندو ته آلس، نند، چڪون ئ بى پرواھيون هونديون. انهي سطح تي ئي توها ان ڪرم به ٿيندا. جنهن گٽ ڪاريه ھر اچي ٿو، اُهؤئي توهانجو ورڻ آهي، سوروب آهي. اهڙي نموني اذ ساتو ڪ راجس مان هڪ ڪلاس ڪوريءَ جو آهي ئ اذ کان گهٽ تامس ئ خاص راجس سان ٻئي درجي جا وئشيه آهي.

هن سوال کي يوگيشور شري ڪرشٽ هتي چوڻون پيرو ورتو آهي. اذياءَ ٻئين ھر انهن چار ورڻن مان هڪ ڪوري جو نالو ورتو ته ڪوريءَ لاءَ يد کانسواءَ ڪوئي رستو ڪونهي. ٿئين اذياءَ ھن چيو ته دربل گٽن واري لاءَ به هنجي سڀاً مان اتنين يوگ ڦيتا جي انوسار ڏرم ھر پورت ٿيڻ، اُن ھر مري ويچن به پرم ڪلياڻ ڪارڪ آهي. ٻين جو نقل ڪرڻ ڏڪائيندڙ آهي. اذياءَ چوڻين ھر ٻڌايو ته چار ورڻن جي سرشي مون ڪئي. ته چا منشن کي چئن جاتين ھر ورهايو؟

چون ٿا-نر، "گٽڪرم وياگشگه" گٽن جي يوگيتا سان ڪرم کي چئن ڏاڪن ھر ورهايو. هتي "گٽ ڪرم وياگشگه" - گٽن جي يوگيتا سان ڪرم کي چئن ڏاڪن ھر ورهايو. هتي گٽ هڪ ماپ آهي، ان جي دواران ماپي ڪرم ڪرڻ چي سمرٿي کي چئن پاڳن ھر ورهايو.

شري ڪرشٽ جي شبدن ھر ڪرم ئي فقط آتم پرش جي پراپتي جي ڪريا آهي. ايشورپراپتي جو آچرڻ آرادنا آهي، جنهن جي شروعات ماتر هڪ إشت ھر شردا سان آهي، هن يگيارت ڪرم کي پاڳن ھر ورهايو. هاڻي ڪئن سمجھون ته اسان ھر ڪھڙا گٽ آهن ئ ڪھڙي درجي جي جا آهن؟ ان لاءَ

هتي چون ٿا.

شماو دمسٽپ: شُئْچَنْ کھانٰنِ رَجَبَ مَهَےَ وَ چَنْ

ڇانْ وِیٰ ڇانِ مَاسِتِ کَيْمَنْ بَرَهَمَ کَرَمَ سَوَيَاوَجَيْرَ ۱۸۲۱

”شَمُودَ مَسِتَّ پَيْهَهَ شَئُورِيَّهَ کَشَانٰنِ تِيرَارَ جَوَ مِيَوَ چَهَ  
گِيَا نِيرَ وَ گِيَا نِما سَتَّ کَيْرَ بِرَهَمَ کَرَمَ سَوَيَاوَجَيْرَ (۱۴۲)  
من جو شمن، اندرین جو دمن، پورڻ پوترتا، من. واڻي ئے  
شرير کي اشت ڏانهن تپائڻ، کميا ڀاُ، من اندرین ئے شرير کي  
سدائين سرلتا، آستک بُڌي معني هڪ اشت ۾ سچو صدق، گـ  
بيان ارتات پرماتما جي ڄاڻ ۾ تيز فهمي، وگيان ارتات پرماتما  
جي ڄاڻ ۾ تيز فهمي، وگيان ارتات پرماتما سان ملڻ وارن  
اُديشن جي جاڳري ۽ اُن جي انوسار هلن جي سگه، هي سڀ  
سڀاً مان اتپن قيل براهمن جا ڪرم آهن ارتات جڏهن سڀاً  
۾ اهي لياقتون پاتيون وڃن، ڪرم ڏارواهڪ ٿي سڀاً ۾ يالجي  
وڃي ته اهو برهمن درجي جو ڪرتا آهي ئه تيئن  
شُئْچَنْ تِهْ جَوَ ڏُتِرِ دَكَشَانَ ۱۸۳۱

”شَئُورِيَّهَ ڏِرِ تِرِ دَكَشَيَّهَ بُڌي چا پِيَپِلا يَنَهَ

دَانَمِيَشَوَرَ پَاوَشَچَهَ کَشَانِ تِرَمَ کَزِمَ سَوَيَاوَجَيْرَ (۱۴۳)

سورويerta، ايشوريه تيچ جو ملڻ، ذيرج، چنتن ۾ دَكَشتا  
ارتات ”ڪرم سُوكُؤَشَلَهَ“- ڪرم ڪرڻ ۾ هوشياري پرڪري  
جي سنگهرش کان نه پيچن جو سڀاً، دان ارتات سڀڪجهه  
سمريپن ڪرڻ، سڀني پاونائين ۾ سوامي ڀاُ ارتات ايشور پاُ-  
هي سڀ ڪوري جي ”سَوَيَاوَجَيْرَ“- سڀاً ۾ اهي لياقتون پاتيون  
وڃن ٿيون ته اهو ڪرتا ڪوري آهي. هاڻي بيان آهي، وئيشيءَ  
شودر جو سوروبـ-

كُوشِيگايرکشِيوا گَيْيِجَيْمَ وَ گَيْشِيَكَرَم سَوَيَا وَ جَيْمَ  
پارِچارِياتِمَكَمَ كَرَمَ شُودَرِسِيَا ڦِي سَوَيَا وَ جَمَ । ١٤٤١

”کِرِشِنَگِئورَ کِشِيوا گَيْيِجَيْمَ وَ گَيْشِيَكَرَم سَوَيَا وَ جَيْمَ  
پَرِيچارِياتِمَكَمَ كَرَمَ شُودَرِسِيَا ڦِي سَوَيَا وَ جَمَ (١٤٤)  
ڪِرِشِي (کيٽي)، گئو رکشا ۽ واپار وئشيه جي سڀاء جا ڪرم  
آهن گئو پالن ئي چو؟ ڏڳي کي ماري ڇڏين؟ اهڙو ڪجهه  
ڪونهي، شودر ويدڪ واعتميمه ۾ ”گو“ شبد انتهڪرڻ ۽ اندرِين  
لاء پڙچلت هو. گو-رکشا جو ارت آهي، اندرين رکشا. وويڪ  
ويراڳ، شم، دَمَ جي دواران اندريون سوگهيون ۽ مضبوط ٿين  
ٿيون ۽ ڪام، ڪرود، لوپ، موهم جي دواران ورا هجي ٿيون  
وچن. هيٺيون ٿي ٿيون وچن. آتمڪ سمپتي ئي استر سمپتي  
آهي. هي اسانجو نج دن آهي، جو هڪ پيرو ساث ٿي وڃي ته  
سدائين ساث ڏئي ٿو. پرڪريٽي جي ڪيٽ ٻٽ مان ُنهن جو  
آهستي آهستي گڏ ڪرڻ واپار آهي) کيٽي؟ شرير ئي هڪ  
آهي، ان جي اندر پوكيل بچ ارتات سنسكار جي روپ ۾ پلو  
برو ڄمي ٿو. ارجن! هن نشكام ڪرم ۾ بچ ارتات آرنڀ جو  
ناس نٿو ٿئي (ُنهن مان ڪرم) پرم تَتَو جي چنتن جو جيڪو  
بچ هن کيٽر ۾ پيو آهي، اُن کي بچائي رکندي ان ۾ اچڻ  
وارن وجاتي وڪارن کي ڪيٽندو وجڻ کيٽي آهي.

ڪُوشِي نِيرَاوَهِ چُتُرِ كِسَانَا ।

ジミ ブധ ٽڄاڻ موهه مَدَمانا । (ماڻس، ٨/١٤/٨)

ڪِرِشِي فِرَا وَ هِنِنَچِئُتَرَ كِسَانَا

جِي ٻُڏ تَجِهِنِ موهم مَدَمانا (ماڻس ١٤-٨)

اهڙي طرح اندرين جو بچاء ۽ پرڪريٽي جي جڳهڙن کان  
بچائي آتمڪ سمپتي کي گڏ ڪرڻ ۽ ان کيٽر ۾ پرم تتو جي

چنتن جي سنپيال - اهو وئشيه درجي جو ڪرم آهي.  
 شري ڪرشن جو انوسار "يگييششتا شندھه" پورتي ڪال  
 ۾ يگيه جنهن کي ڏئي ٿو، هو آهي پورو برهم اُن جو پان  
 ڪرڻ وارا سنت جن سڀني پاپن کان چتي وڃن ٿا ئه اُن جو  
 آهستي آهستي چنتن-ڪريا سان ٻج لڳائڻ جو ڪم ٿئي ٿو.  
 انجو بچاءِ کيتي آهي. ويدڪ شاسترن ۾ اُن جو ارت آهي  
 پرماتما، پرماتما ئي هڪڙو کادمي-کائڻ جي ڪريا آهي،  
 آن آهي. چنتن جي پورتي ڪال ۾ هيءَ آتما پوري طرح  
 ترپت ٿي وڃي ٿو،وري ڪڏهن اترپت نتو ٿئي، آواگمن  
 ۾ نشي اچي. هن ان جي ٻج کي ڄمائيندي اڳيان وڌڻ  
 ڪريپي (کيتي) آهي.

پاڻ کان انتيءَ واري اوستا وارا، پراپتي وارن گروجن جي  
 شيوا ڪرڻ شودر درجي جو سڀاءِ مطابق ڪرم آهي. شودر جو  
 ارت نيق نه پيءَ بنا ننديو آهي. نمائڻي درجي جو سادڪ ئي  
 شودر آهي، داخل ٿيڻ واري درجي جو اُهو سادڪ شروعات کان  
 ئي شروع ڪري.

آهستي آهستي شيوا سان هن جي هردي ۾ اُنهن سنسكارن  
 جو سرجن ٿيندو ئه نمبروار هلي هو وئشيه، کتري ۽ براهمڻ  
 تائيں دوری طئه ڪري ورڻن کي به پار ڪري برهم ۾ پرويش  
 پائي ويندو سڀاءِ بدلجنڌ آهي. سڀاءِ جي پريورتن سان ورڻ -  
 پريورتن ٿي وڃي ٿو. حقiqet ۾ هي ورڻ، تمام اُتم، اُتم،  
 مديم ۽ نشكريت چار اوستائون آهن، ڪرم پت تي هله وارن  
 سادڪن جون اوچيون-هينيون چار ڏاڪطيون آهن ڪرم هڪ  
 ئي آهي، نيت (مقرر) ڪرم. شري ڪرشن چون ٿا تم مشهوري  
 حاصل ڪرڻ جو هيءَ ئي هڪ رستو آهي تم سڀاءِ ۾ جهڙي يوگ

يٽارٽ گٽا : شريمد ڀگود گٽا

يٽا آهي، اٽان ئي لڳون. هن کي ڏسو.

سٽه سٽه کرٽٽي بھيرٽ سٽسٽدٽ لٽهٽ نٽه.

سٽه کرٽٽي نٽه: سٽدٽ يٽا وٽهٽ تٽه.

”سٽوي سٽوي ڪرٽٽي پٽر تٽه سٽسٽدٽ لٽهٽي نٽهه

سٽو ڪرٽٽي پٽر تٽه سٽدٽ يٽا وٽهٽ تٽه (٤٥)

پنهنجي پنهنجي سٽاء ڦهئٽ واري يو گٽا جي انوسار

ڪرم ۾ لڳل منش ”سٽسٽدٽ“ ڀگوت پراپٽي روپٽي پرم سٽي

کي پراپٽ تئي ٿو. پھريں به چئي آيا آهن. هن ڪرم کي

ڪري تون پرم سٽي کي پراپٽ ٿيندين.

ڪهڙو ڪرم ڪري؟ ارجن! تون شاستروٽي جا نٽدارت

ڪرم، يٽيار ڦڪرم ڪر. هاڻي سٽو ڪرم ڪرڻ جي بل جي انوسار

ڪرم ۾ لڳل منش پرم سٽي کي ڪهڙي پرڪار پراپٽ تئي

ٿو، اٽا وٽي تون مونکان بُڏ-ڏيان ڏيو.

يٽه: پٽو ٻٽٽ ٻٽٽا نام ڦهٽ سٽه بھيد تٽه.

سٽه کرٽٽا تٽه بھي سٽدٽي سٽه: سٽه بھي سٽه.

”يٽهه پٽور تٽر پٽوانا ه يٽه سٽو ڦم ڦر تٽر ا

سٽو ڪرم ڻا تٽپٽي چرٽي سٽه ۾ وٽهٽ ٽيمانوهه ١١ (٤٦)

جنهن پرماتما کان سڀني ڀوتن جي اٽپٽي ٿي آهي، جنهن

سان هي سمپورڻ چڳت ويٽپٽ آهي، اٽ پرميٽشور کي

”سٽو ڪرم ڻا“ پنهنجي سٽاء کان اٽپٽن ٿيل ڪرم جي دواران

پوچا ڪري منش پرم سٽي کي پراپٽ ٿيندو آهي. هاڻي

پرماتما جي ڀاونا ۽ پرماتما جو سڀني انگن سان پوچا ڏاڪو

ڏاڪو ڪري هلٽ ضروري آهي. جيئن ڪوئي وٽي درجي ۾

وٽي وڃي ته نندو درجو به وڃائي وهندو، وڏو درجو ته ملندو

ئي ڪونه. هاڻي هن ڪرم پٽ تي ڏاڪو ڏاڪو ڪري هلٽ جو

وڏان آهي. جيئن ۶ ۱۸ ۰. ان تي وري زور ڏئي چون ٿا  
ته توھين ڀلي ڪڻي ٿوري سماجهه وارا هجو، اُٿان شروعات  
ڪريو. اها وڌي آهي، اهو ئي طريقو آهي - پرماتما جي لاءُ  
سمريپڻ.

### શ્રેયાન્સ્વધર્મો વિગુણ: પરધર્માત્સ્વનુષ્ઠિતાત્। સ્વભાવનિયતં કર્મ કુર્વન્નાપ્રોતિ કિલ્બિષમ् ॥૪૭॥

”શ્રીયાન્સ્વધર્મો વિગુણ પ્રાર્થને પ્રાર્થના માટ્સ્યોનું શિન્તાત  
સ્વોધાન્સ્વધર્મો કર્મ કર્વનાપ્રોતિ કિલ્બિષમ् ॥૪૭॥  
چڱી ત્રણ શરૂ કંડી બેચી જી દરમ કાન ગુંઠ રહેત બે  
પનેંગ્ઝો દરમ પ્રમ કલિાળકારી આહી. ”સ્વોધાન્સ્વધર્મો“ સ્થાને કાન  
નરદારત કીલ. કર્મ કંડી કંડી મન્શ પાપ એરાત આવાગ્મન  
કી પ્રાપ્ત નાચું તૈયા. ગુંઠો કર્યા સાદકન કી ખ્ફકાની તીથે  
લેંદી આહી તે એસીન શિઓ કંદા તી રહન્દાસીન. હો તે ડીયાન ۽  
અસ્તે આહેન. સન્ન ગુંઠું જી કર્યા સન્દન સન્માન આહી. તરત હો  
નેલ કરું લેંદા આહેન. શ્રી કર્ષ્ણ જી અનોસાર નેલ યા હસ્ત માન  
કુંજમણ મણન્દો કુંન. પનેંગ્ઝી સ્થાને સાન કરું કરું જી બેલ  
જી અનોસાર કર્મ કર્યા તી કુ મશ્હોરી પાચી ત્થો. ચ્છુંદું સાન  
ના.

### સહજં કર્મ કૌન્તેય સદોષમપિ ન ત્યજેત્। સર્વારમ્ભા હિ દોષેણ ધૂમેનાસ્ત્રિરિવાવૃત્તા: ॥૪૮॥

”સહજિ કર્મ કૌન્તેય સદોષમપિ ન ત્યજેત્  
સર્વારમ્ભાયે દોષેણ ધૂમેનાસ્ત્રિરિવાવૃત્તા: ॥૪૮॥  
કુન્તેયિ! ઉબન સાન પ્રિબેલ (ગહેત સમાજને ઓસ્તા વારો સ્દુ  
આહી તે દોષ ગુંઠા આહેન. એત્યો દોષ યિક્ત કી બે), સહજ કર્મ  
કી તિયાગ્ન ને ક્પિ, ચાકાણ તે દોનહીન સાન અંગી જી સામ્હનોન

સ્પીયેચિ ક્રમ કન્હન ને કન્હન દોશ સાન ગ્હેરિયા આહેન. બ્રહ્મણ દ્રજિ તી સહીન, ક્રમ તે ક્રોટ્ઠ પ્રોથી તો. એસ્થિયા ને મલ્લિ, તિસ્ટાનીન દોશ ઝાહર આહેન. પ્રકૃતી જો પરદો ઝાહર આહી. દોશન જો એન્ટ અતી ત્યિન્દો, જ્તિ બ્રહ્મણ દ્રજિ જા ક્રમ બે બ્રહ્મ હી પ્રાર્વિષ સાન ગ્રદ્ધ લીન તી વ્જન તા. અનુભૂતિ વારન જા લક્ષ્ણ ચા આહેન. જ્તિ ક્રમન સાન કો પ્રાર્વિજન તી ન્તો રહાજી વ્જિયા.

અસક્તબુદ્ધિ: સર્વત્ર જિતાત્મા વિગતસ્પૃહાઃ।  
નૈષકર્માસિદ્ધિં પરમાં સત્ત્રાસેનાધિગચ્છતિ॥૪૯॥

”આસ્કેટિબ્દ યિખે સર્વોત્તરજટાત્મા ઓન્તસ્પીર હ્યા  
નૈષિશ્કર મિસ્ત્ર પેરમાં સન્નિસીનાં ગ્જાત્યિ (૪૯)  
સ્પી કન્હન આસ્તકી (મોહ) કાન રહેત બ્દ્યી વારો કામના  
કાન બલ્કલ રહેત જિતીલ અન્તેક્રોટ વારો પ્રશ “સન્નિસીનાર” સ્પી  
ખ્રાબ ઉદ્તોન ચ્છેદ જી ઓસ્તા હી પ્રમ નૈષિશ્કરિય જી સ્દ્યિ કી  
પ્રાપ્ત તૈયી તો. હેતી સન્નિસાસ હી પ્રમ નૈષિશ્કરિય સ્દ્યિ સાગ્યી  
આહી. હેતી સાનકીય યોગી અતી તી પ્રાપ્ત તૈયી તો, જ્તિ તે નશકામ  
ક્રમ યોગી. એ પાણેની બન્હી માર્ગન લાએ સ્માન આહી. હાથી પ્રમ  
નૈષિશ્કરમિય સ્દ્યિ કી પ્રાપ્ત તૈલ પ્રશ જીનીન કી પ્રાપ્ત  
તૈયી તો. અનુભૂતિ હી ચ્છેદ કન તા.

સિદ્ધિં પ્રાસો યથા બ્રહ્મ તથાપ્રોતિ નિબોધ મે।  
સમાસેનૈવ કૌન્તીયે નિષા ગ્યાનસીયે યા પરા॥૫૦॥

”સ્દ્યિ પ્રાપ્તો યિતા બ્રહ્મ તનાપ્નોત્પી નિબોદ્ધ મી  
સમાસિનૈયો કૌન્તીયે નિષા ગ્યાનસીયે યા પરા (૫૦)  
કૌન્તીયે ! જા ગ્યાન જી પ્રિન્ષ્ટા આહી, ચ્છોત આહી, મથી  
આહી, અનુભૂતિ સ્દ્યિ કી પ્રાપ્ત તૈલ પ્રશ જ્ઞ બ્રહ્મ કી પ્રાપ્ત

ٿئي ٿو، اُن وڌيءَ، اُن طريقي کي تون مونکان ٿوري ۾  
چاڻي وٺ. اڳين شلوڪ ۾ اهائي وڌي ٻڌائي رهيا آهن،  
ڏيان ڏيو.

بُڏڙا فيشُڙا يُوكُو ڏُختاً تما نِ نِيَمْيَهْ چَ ١  
شَبَدَه دِيَنُو شَيَا فِسْتِيَهْ كِتَوَا رَأَكِدِيَشْهُ وَيُدَ سَيَ چَ ٢ (٥١)

”وَكِتَسِيهُوي لَكِهِه وَاشِي يَتَوَا كَكَيَهْ ما نَسَخَه ٣  
”دِيَانِيَوَگِپَرَو نِتِيَمْ وَتِرَاهِيَهْ سَمْپَا شَرَتَهَ ٤ (٥٢)

”بُدَّ يَا وَسْدَ يَا يُكتُو ڏِرِ تِيَاتِمَانِه نِيَمِيَهْ چَ ١  
شَبَدَه دِيَنُو شَيَا فِسْتِيَهْ كِتَوَا رَأَكِدِيَشْهُ وَيُدَ سَيَ چَ ٢ (٥١)  
ارجن ! خاص روپ سان بُدَّ سْدَ سان مليل، ايڪانت ۽ شب  
ديش جو سيون ڪرڻ وارو، سادنا ۾ جيترو سهايڪ هجو اوترو  
ئي آهار ڪرڻ وارو، جيتيل من، واطئي ۽ سريرووارو دريد ويراڳ  
کي چڱي طرح پراپت ٿيل پرش هميشه ڏيان يوگ ۾ قربان ٿيل  
۽ اهڙي ڏارڻا سان مليل ارتات ان سڀ کي ڏارڻ ڪرڻ وارو ۽  
انتهڪرڻ کي وس ۾ ڪري شبد وغيره وشين کي تياڳي، راڳ  
دويش کي نشت ڪري - ۽

اھڙا رَ بَلَانَ دَرَجَةَ كَامَانَ كَوَافِدَهْ

فيِسِعَ نِيرَهْ شَانَنَو بَرَهَمَيَهْ يَا يَهْ كَلِپَتَيَهْ ٦ (٥٣)

”اھنِڪاَرَهْ بَلَهْ دَرِ پَيَرَهْ كَامَهْ كَرَوَهْ بَرِيَغَرَهْ  
وَمُهَجِيَهْ نِيرَهْ مَمَهْ شَانَنَو بَرَهَمَيَهْ يَا يَهْ كَلِپَتَيَهْ (٥٣)  
اھنڪار، بل، گھمند، ڪام، ڪروه، باهريون شيون ۽ إندرین  
جي چنتنن کي تياڳي، ممتا رهت، شانت انتهڪرڻ ٿيل  
پرش پر برهم سان گڏجي ايڪي ياُ هي لاءِ يوگيه ٿيندو آهي

ાગ્નિબાન ડસોન -

**ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति।**

**समः सर्वेषु भूतेषु मद्वक्तिं लभते पराम्॥५४॥**

”**બ્રહ્મ પ્રુત્કે પ્રસનાત્મા ને શુચ્ચત્ય ને કાંક્ષકાંક્ષત્યે**  
સ્વરૂપિશ્શુ પ્રુત્કે મદ્ પ્રુત્કે લીપ્ત્યે પ્રામ (૫૪)  
બ્રહ્મ સાન એકી પાં હેઠળ જી યોગીતા વારો અહો પરસન  
ચ્છત્પરશ ને તે કન્હન વસ્તો લાં શ્વોક કરી ત્વો ને કન્હન  
જી તેમના, એચા તી કરી ત્વો. સ્પિની પ્રુત્ન કુરી પાં અહો પીપ્ત્યે  
જી ચ્વોત્યે તી આહી. પીપ્ત્યે પન્હન્ગ્જો ક્લ ડીટ્ખ જી એસ્ટ્ટ્યુ કુ  
આહી, જેતી બ્રહ્મ કુ પ્રોવિશ મલી ત્વો - હાથી  
ભક્ત્યા મામભિજાનાતિ યાવાન્યશ્વાસ્મિ તત્ત્વતઃ।

**તતો માં તત્ત્વતો જ્ઞાત્વા વિશતે મદનન્તરમ्॥५५॥**

”**પીક્તિયા મામ્પિજાનાત્યી યાવન્યિશ્વચાસ્મી તન્તો તન્કે**  
તન્તો માં તન્તો તો ગ્યાત્રા વિશ્વત્યે તન્તોન્તર્મ (૫૫)  
અન પ્રાબ્ધીત્યે જી દોવારાન હો મુન્કી તન્તો સાન ચ્છ્યે ટ્રે  
જાણું તા. અહો તન્તો આહી ચા? માન જો એ જન્હન પ્રિયા વારો આહીયાન,  
અન્ન એર-પોતર શ્વી જુન લુલક ગુંધરમન વારો આહીયાન, અનુંકી જાણું  
તા એ મન્હન્ગ્જી તન્તો કી જાણી હુક્ક્રમ એ મુન કુ પ્રોવિશ કરી  
ઓઝી ત્વો. પ્રાપ્તિ કાલ કુ તે બેગ્વાન ડ્સ્પ્ટ્ટ કુ એચ્યી ત્વો પ્રાપ્તિ કાન  
નીક પોં અન્હી તી પિલ પન્હન્ગ્જી તી આત્મ સરૂપ કી અન એશ્વરી  
ગુંધરમન સાન મલીલ પાઈ ત્વો તે આત્મા હી એર, એર, પોતર,  
ઝાહરને, લક્લ એ સનાતન આહી.

બેચી એડ્યા કુ યોગીશ્વર ચ્યાં હો. આત્મા તી સ્ત્રીમે આહી, સનાતન  
આહી, લક્લ એ એર સુરૂપ આહી, પર અન્હન વિયોત્તીન સાન પ્રિયલ  
આત્મા કી ફ્લેક તન્તો દરશિન ડન્નો. હાથી સ્વીાઓયિક આહી, તે

حقیقت هر تَتو درشتا آهي چا؟ گهٹا ماڻهو پنج تَتو، پنگوبههن تَتون دماغي ڳڻپ ڪرڻ لڳن ٿا، پر اُن تي شري ڪرشن هن ارڙهين اڌياء هر فيصلو ڏنو آهي ته پرم تَتو آهي پرماتما. جو اُن کي ڄائي ٿو، اهوئي تَتو درشي آهي. هائي جيڪڏهن توهان کي تَتو جي چاهه آهي ته ڀچن ئ چنتن ضروري آهي. هتي سلوک اُلُونجاھين کان پنجونجاھه تائين یوگيشور ڪرشن صاف ڪيو آهي ته سنیاس مارگ هر به ڪم ڪرڻو آهي. هنن چيو "سنیاسین" سنیاس دواران (مطلوب ته گيان یوگه جي دواران) ڪرم ڪندي اچا کان رهت، آ سکتيء (موه) کان رهت ئ شد انتهڪرڻ کي جيئن وارا پرش جهڙي طرح نشڪام ڪرم جي سڌيء کي پراپٽ ٿين ٿا، اُن کي ٿوري هر ٻڌائيندس. اهندكار، بل، گھمند، ڪام ڪروڏ مد موهم وغيره پرڪريء جا ڪيرائڻ وارا وڪار جڏهن سڀ طرح شانت ٿي وڃن ٿا ئ وويڪ، ويراڳ، شمر، دم، ايڪانت هر رهڻ، ڏيان وغيره برهم هر پرويش ڏيارڻ واريون یوگيتائون جڏهن پوري طرح رچي راس ٿين ٿيون، اُن وقت هو برهم کي ڄائڻ یوگيه ٿيندو آهي. اُن یوگيتا جو نالو آهي پرا ڀيٽي. ان یوگيتا دواران هو تَتو کي ڄائي ٿو. تَتو آهي چا؟ مونکي ڄائي ٿو. پڳوان جيڪو آهي، جن ويٺين سان پريل آهي اُن کي ڄائي ٿو ئ مونکي ڄائي هڪدم مون هر استت ٿي وڃي ٿو. ارثات برهم، تَتو، ايشور پرماتما ئ آتما سڀ هڪ ٻئي جهڙا آهن، ساڳيا آهن. هڪ جي ڄائڻ سان سڀني جي ڄائڻ ٿي وڃي ٿي. هيء پرم سڌيء، پرم گت ئ پرم ڏام به آهي.

هائي گيتا جو درد وشواس آهي ته سنیاس ئ نشڪام ڪرم یوگه بنهي حالتن هر پرم نشڪئريه سڌيء کي پائڻ لاء نيت

ڪرم (چنتن) تمام ضروري.

هيلتاين تو سناسي جي لاءِ ڀجن چنتن تي زور ڏنو ۽  
هاڻي سمرپڻ چئي اُنهي وارتا کي نشڪام ڪرم يوگي جي  
لاءِ به چون ٿا -

کَرْكَمَارْجَيْهِي سَدَا كُرْوَانَهِي مَدْبُعَهِيَهِي

مَطْرَسَادَادَ وَأَپَنَوْتَيِ شَاهَوَتَهِ پَدَ مَوَيَّهِيَهِي

”سرُوكِرمائِيپِي سدا ڪروانُو مَدِويَهِي شَاهَيَهِي  
مَتِپَرَ سادَادَ وَأَپَنَوْتَيِ شَاهَوَتَهِ پَدَ مَوَيَّهِيَهِي (٥٦)  
مونتي پورو ڀرسو رکندڙ پرش سمپورڻ ڪرمن کي سدا  
ڪندي، ذري ماتر به گهتناي نه رکي ڪندي منهنجي ڪرپا -  
مهر سان پوتر، اوناشي پرم پد کي پراپت ٿئي ٿو. ڪرم اُهو  
ئي آهي. مقرر ڪرم چنتن ڀگيه جي پرڪريا. پورڻ يوگيشور  
ستڙو جي آسري ساڌڪ اُنهنجي- ڪرپا - مهر کي جلد ئي پائي  
وئي ٿو. هاڻي ان کي پائڻ لاءِ پورڻ سمرپڻ ضروري آهي .

چَهَسَاسَ سَرْكَمَارْجَيْهِي مَهِي سَطْرَسَيْهِي مَتَّهِرَهِي

بُدْ يَبِوَگَمْپَا شَرِتَهِ مَجَچَتَهِ سَتَّنَهِ پَوَهِهِي

”چيتسا سرو ڪرمائي ميءِ سندنيسيهِ مَتِپَرَهِهِي  
بُدْ يَبِوَگَمْپَا شَرِتَهِ مَجَچَتَهِ سَتَّنَهِ پَوَهِهِي (٥٧)  
هاڻي ارجن ! سمپورڻ ڪرمن کي (جيترو توکان ٿي سگهي  
ٿو) من سان مونکي ارپڻ ڪري، پنهنجي ڀروسي نه بلڪ مونکي  
سمپورڻ ڪري، منهنجي آسري ٿيل بُدئي يوگ معنلي يوگه جي  
بُدئي ۽ جو آسرو وئي هميشه موں ۾ چت لڳاءِ. يوگ هڪ ئي  
آهي، جو سڀني دُکن ڪشتن جو انت ڪرڻ وارو آهي ۽ پرم  
تَّهُو پرماتما ۾ پرويش ڏيارڻ وارو آهي. هن جي ڪريا به هڪ  
ئي آهي - ڀگيه جي پرڪريا، جا من توڙي اندرین جي سنجم،

سواس-پساھه توڙي ڏيان وغیره تي آدارت آهي. جنهنجو  
قل بَه هَكَ ئَي آهي - "يَانِتِي بِرَهَمَ سَنَاتَنَرَ" ان تي اڳيان  
چون تا:-

**મચ્ચિત્ત: સર્વદુર્ગાણ મત્પ્રસાદાત્તરિષ્યસિ।**

**અથ ચેત્ત્વમહદ્વારાત્ર શ્રોષ્યસિ વિનદ્ધક્ષયસિ॥૫૮॥**

"માચ્ચિનન્હે સરો દુર્ગટી મંત્રપ્રસાદ તિર્યશિસ્યિ  
આઠ ચીત્તોમહનકારાન શ્રો શ્રીસ વિનન્કશિસ્યિ (૫૮)  
ان طرح مون ۽ સદાએન ચત લેગાન્ટ વારો થી મનેનજી  
કૃપા સાન મન આંદરીન કી સ્મીપૂર્ણ પ્કર્ષ્ણ જી ઓરિ ઓરિ  
કુશ્શ કૃષ્ણ સાન ત્રી વિન્ડીન "અન્દરિન્હે દોર જ્હરો કા નાના આ  
નન્હેન નન્હેન સુર્બેન્ની કર તાતા આવત દિક્ષે વશીભ બીયરી આ તી  
હેઠ દિયેન કેપાત અગ્હારી" આહી થી એશી એક્યુન આહેન.  
મનેનજી કૃપા સાન તોન એનુન રંદ્દું તી હમ્લો કૃય પારથી  
વિન્ડીન, પ્ર જિક્દુન એનકાર જી કૃય મનેનજી વચ્ચન કી  
ને બુદ્ધિન્દીન, તે નાસ થી વિન્ડીન, પ્રમાર્થ કાન પ્રી થી વિન્ડીન.  
ଓરિ અન તી ઝૂર ઢીયી છુન થા.

**યદહદ્વારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે।**

**મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વાં નિયોક્ષ્યતિ॥૫૯॥**

"યદ હનકાર માશ્રતીય ને યોત્સ્યિય ઇતી મનીસ્યિ  
મિથ્યૈષ વ્યોસા યીસ્તી પ્રકરિયિસ્ત્તોમ નિયોક્ષ્યિય (૫૯)  
જી તોન એનકાર જો આસ્રો વની એનીન તો મજીન તે યદ ને  
કંદસ, તે એ હો નનેનજો નશ્ચ્યો મત્યા આહી, ચાકાણ તે નનેનજો  
સ્પીઅ તોકી ઝૂરી યે યદ ۽ લેગાયી ચ્છીન્દુ.

**સ્વભારજેન કૌન્તેય નિબદ્ધ: સ્વેન કર્મણા।**

**કર્તું નૈછસિ યન્મોહાત્કરિષ્યસ્યવશોડપિ તત્॥૬૦॥**

”سوپا وچين ڪونتييه نبَّه هم سويين ڪرمڻا  
 ڪر تُر نيكسي ينموهاتي ڪريشيسيوشو پي دت“ (٦٠)  
 ڪونتييه! موھ جي وس تون جنهن ڪرم کي نتو ڪرڻ  
 چاهين، اُن کي به پنهنجي سڀاً کان اُتپن ٿيل ڪرم سان ٻڌل  
 هئڻ سبب پروس ٿي ڪندين. پرڪري جي ٿکراء کان نه  
 ڀڪڻ جو تنهنجو ڪوري درجي جو سڀاً توکي مجبور ٿي  
 توکي ڪرم ۾ لڳائيندو. سوال پورو ٿيو. هاڻي اُھو ايشور  
 رهي ڪتي ٿو؟ ان تي چون ٿا

ڦيشر: سર्वभूतानं हृदेशोऽर्जुन तिष्ठति।

ખ्रામયન્ત્સર્વભूતાનિ યન્ત્રારૂઢાનિ માયયા॥૬૧॥

”ايشورکه سرو ڀوتانا ۾ هرديشير جن تشننتي  
 پرامينسرو ڀوتاني ينترارو ڙهاني ماييا“ (٦١)  
 ارجن! اھو ايشور جو سيني ڀوت پراڻين جي هرديه ديش  
 ۾ نواس ڪري ٿو. ايترو ويچهو آهي تم لوڪ ڄاڻن چون نه ٿا؟  
 مايا روپي ينتر ۾ ڊڪيل هئڻ سبب سڀ لوڪ ڀرم جي وس ٿي  
 چڪر لڳائي رهيا آهن، تنهن ڪري نتا ڄاڻن . اھو ينتر وڏو  
 شكاري آهي، جو ور ناسونت شريرن ۾ گھمندو ٿو رهي. تم  
 شرڻ ڪنهنجي وٺون؟

તમેવ શરણ ગચ્છ સર્વભાવેન ભારત।

તતપ્રસાદાત્પરાં શાન્તિં સ્થાનં પ્રાપ્સ્યસિ શાશ્વતમ्॥૬૨॥

”تميو شرڪِير گچ سرو ڀاوين ڀارت  
 تنتپر سادا ٿپرا ۾ شانتير ستابير ڀراپيسپي شاشو تير (٦٢)  
 تنهن ڪري هي ڀارت! سمپورڻ ڀاو سان ان ايشور جي (جو  
 هردي ديش ۾ براجمان آهي) انيئيه شرن کي پراپت ٿيءُ هن  
 جي ڪرپا مهر سان تون پرم شانتي، پوتر پرم ڏا مر کي پراپت

ٿيندين. هاڻي ڏيان ڪرڻو آهي ته هرديه ديش ۾ ڪيون. اهو چاڻندي به مندر مسجد، چرج يا ٻئي هند ڳولههٽ وقت بر باد ڪرڻو آهي. ها! جيستائين چاڻ نه آهي تيستائين سوپاويڪ آهي. ايشور جو رههٽ جو استان هرديه آهي. پاڳوت جي چئن شلوڪن جي گيتا جو تاپرچ به اهو آهي ته ائين ته مان هر هند چتي ڪشي آهيان، پر پراپت ٿيان ٿو هرديه- ديش ۾ ڏيان ڪرڻ سان ئي.

इति ते ज्ञानमार्ख्यातं गुह्यादगृह्यतरं मया।

विमृश्यैतदशेषण यथेच्छसि तथा कुरु॥६३॥

”اٽي تي گيانما کياٿم گھياد گھيائِترم ميا  
ومِرِشِئُوتَدْ شِيشِيَطْ يَتِيَچِسِي نَتَا گَرُو“ (۶۳)

اھتريء طرح بس اينترو ئي ڳجي ڪان ڳجي گيان مون تنهنجي لاء چيو آهي. ان طريقي سان، وڌيء سان سمپورڻ روپ سان ويچار ڪر، پوءِ تون جيئن چاهين ٿو تيئن ڪر. سٽيئر اهو ئي آهي، پائڻ جو هند اهو ئي آهي، پراپتيء جي، ڳولڻ جي جڙهه به اها ئي آهي پراپتيء جو مارگه به اهو ئي آهي. پر هردي ۾ وينل آهي ڏسٹ ۾ نتو اچي، ان تي اُپاء ٻڌائين ٿا:-

سَرْجُونْهُمْ بَعْدَ: شُرْجَنْ مِنْ بَعْدِهِمْ  
इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम्॥६४॥

”سَرْ وَ گِمِيَّتَمِيرْ بِيُوْ يَهَ شِرِّيُوْ مِي پَرَمِيرْ وَچَهَه  
إِشْتُوْسِي مِي دِرِيَّتِي تَوْ وَكْشِيَامِي تِي هِتِير“ (۶۴)

ارجن! سمپورڻ ڳجي ڪان تماڻ ڳجي رهسيه پريل وچن کي تونوري بُڏ (بُڏايا اٿموري به بُڏ). ساڌڪ لاءِ اشت (پرماتما) سدائين سجا ڳهه بينو آهي) چاڪاڻ ته تون تماڻ

منهنجو پیارو آهین، تنهنجکري پرم پلی وارا وچن مان  
وري تنهنجي لاء چوندس - اهو آهي چا؟

ماننا بھا مڈڪو مڍاڙي ما ناماسکرو!

ما مەۋېئىسى ساتي تە پرتىجانى پرىوسىمە ۱۱۶۵॥

”مَذْمَنَا يَوْمِ مِدِيَكْتُو مَدِيَاجِي مَا هِنْمَسْكُرْ

ماميوئىشىسى سَتِيَّهِرْ تى پَرَتِيَجَانِي پَرَيُوسِيمِي ۱۱۶۵(۲۵)  
ارجن ! تون مون ھ ئى (بئى ڪنھن ھ نه) مَن وارو ٿيءُ  
منهنجو انِيَنِيهِمْ پِيگَتْ ٿيءُ، منهنجي لاء پورڻ شردا وارو  
ٿيءُ(منهنجي سمپرڻ ھ تنهنجون اکيون پريم ھ پرجي اچن،  
مونکي ئى نمسكار ڪر. ائين ڪرڻ سان تون مونکي ئى پراپت  
قىندىن ين. اها مان تنهنجي لاء سچي پرتگيا ڪري چوان ٿو،  
چاكاڻ تە تون مونکي بىگد پیارو آهين - اڳيان ٻڌائى آيل ايشور  
هرديه-ديش ھ آهي، ان جي شرڻ ھ وچ. هتي چون ٿا منهنجي  
شرڻ ھ ئى ڳجهى كان ڳجها وچن ٻڌي منهنجي شرڻ  
ھ اچ. حقىقت ھ يوگىشور شري ڪرشٽ چوڻ چا ٿا چاهين؟ اهو  
ئي سادڪ لاء ستگروء جي شرڻ تمام صروري آهي. شري ڪرشٽ  
پاڻ هڪ پورڻ يوگىشور هو. هاڻي سمرپڻ جي وڌي ٿا ٻڌائين  
ٿا.

سર்வधर्मान्परित्यज्य मामेकं शरणं ब्रज।

अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥६६॥

”سَرَوَدَ رَمَانِيَّرِيَّجَه مَامِيَّكِيرْ شَرَكِيرْ وَرَجْ

آهِيرْ تِوا سِرَوَپَا پِيپِيپِي موکشىشىامي ما شُچَھَه ۱۱۶۶(۲۶)  
سڀني ڏرمن کي تياڳي (معني) مان برهمڻ جو ڪرنا آهيان،  
يا شودر شريطي جو ڪترى آهيان، يا وئشىه آهيان - انهي  
وپچار کي تياڳي) فقط هڪ منهنجي، صرف منهنجي شرڻ

کي پراپت ٿيءُ. مان توکي سڀني پاپن کان مڪت ڪندس  
- تون شوڪ نه ڪر.

انهن سڀني براهمڻ، ڪترى وغيرة جو گوبه ويچار نه  
ڪر (اهو به نه سوچ ته ان سلسلی ۾ مان ڪھڙي سطح تي  
آهياب) جو هڪ چت من سان، پاڻ سان منهنجي شرن ۾  
اچي وڃي ٿو، بنا إشت (پرماتما) جي ڪنهنجي به نتو  
ڏسي، اُن جي نمبروار، سلسلی وار ورڻن جي بدل-سدل  
اٿان ۽ سڀني پاپن کان نورتي (موکش) جي جوابداري هو  
إشت ستگرو پاڻ پنهنجي هٿن ۾ ڪطي وئي ٿو.  
هر هڪ مها پرش ائين ئي چيو آهي. شاستر جڏهن  
لکجن ٿا ته لڳندو آهي ته هيءُ سڀني جي لاءِ آهي، حققت  
۾ اهو شرداوان لاءِ ئي آهي. ارجن اڌڪاري هو، هائڻي اُن  
تي زور ڏيئي چيو. هاڻي یوگيشور پاڻ فيصلو ڏين ٿا ته  
اُنجو اڌڪاري ڪير آهن؟

ڏينهنجي هٿن ٿا ته ناٿاسڪايو ناٻڪايو کدآچاڻ

ن چاشُوشَوَهُ وَأَنْجَيَهُ نَمَّا يَكْتَاهِيَ كَدَاچَنَ

”ادهُرٰ تي نا تِپِسِکايمَ نا يِكتايمَ كَدَاچَنَ  
نمَّا چاشِشِروُ شوي وَأَنْجَيَهُ نَمَّا يَوِيپِيسُوَيَتِيَ (٦٧)  
ارجن اهڙيءُ طرح منهنجي ڀلي لاءِ چيل هيءُ گيتا جي  
اُبديش کي ڪنهن به سميه ۾ ڀلجي به تپ رهت، سادنا رهت  
منش کي نه چوڻ کپي ۽ نه ڀگتي بنا منش کي ٻڌائڻ کپي، نه  
اُن کي ٻڌائجي جنهنجي ٻڌن جي اچا نه هاجي ۽ جيڪو  
منهنجي نندا ڪري ٿو اهو دوش آهي، ڏوھ آهي، ان طرح  
ڪوڙي آلوچنا: ڪري، اُنكى به نه ٻڌائڻ گهرجي. مهاپرش  
ئي ته هئا جن جي ويچهو سارا هه ڪرڻ وارن سان گڏ ڪپتي

نندک بہ رهیا ہوندا۔ انھن کی تھے نہ بڈائیٹ کپی۔ پر سوال  
شیاویک آھی؟ تھے بڈایون ڪنهنکی وجی؟ ان تھے ڈسون۔

يَ إِمْرٍ يَرْمِلُ كُلَّ مَنْجِلٍ مَدِيْكِتِيْشُوْ يَيِّدَا سِيَتِيْ

بَحْكِتِيْنْ مَيِّيْ يَرْأِيْلُ كِرِتُوا مَا مِيْوَئِيْشِتِيْسِنْشِيْهَ (۲۸)

جیکو منش منهنگی پراپت کری ہن پرم  
رہسیب گیتا جی اپدیش کی منهنگی پیتن کی بڈائیندو، اُھو  
بنا ڪنهن شنکا جی مونکی پراپت ٿیندو. مطلب تھے اُھو پیگت  
مونکی ئی پائیندو، جیکو بڈندو چاڪاڻ اپدیش کی چگیءَ  
طرح هردي ۾ گرهن ڪندو تھے اُن تھے هلندو تھے پار پائی لھندو.  
ھاطی اُن اپدیش ڪرتا جی لاءِ چون تا:-

نَ�َ تَسْمَانْمُنْجِلَةَ كَشْنِنْمَهِيْسُوْ كَشْچِنْمِيْ بِرَيْكَرَ تَمَهَهْ

بَحْفيَتَا نَ�َ چَهَ مَيِّيْ تَسْمَادِيْهَ بِرَيْتَرُو يُوِيْ (۶۹)

نے انھن کان وڌیک منهنگو پیارو ڪاریه ڪرڻ وارو منش  
۾ ڪیر آھی ئے نے انھن کان وڌیک تمام پیارو ہن پرتویءَ تی  
کو ٿیندو. ڪنهن کان؟ جیکو منهنگی پیتن ۾ منهنگو  
اپدیش ڪندو، انھن کی انهی راھ تھی هلائیندو چاڪاڻ تھے  
ڪلیاڻ جی اها ئی پرم ڈارا آھی، راج مارگ آھی. ھاطی  
ڈسون اڌیں (اپیاس)

أَدْيَلَةَ تَرْجِعَتِهِ يَ إِمْرٍ يَرْمِلُ دَمَارَهُ

جَنَاحَيَنْ تَنَاهِيْمِيْسُوْ سِيَامِتِيْ مِيْ مِتِيْهَ (۷۰)

جو پرش هن ڏارمَمِيَه اسان بندھي جو سنوا د کي ”آڌِ يشٽي‘ چڱي ء عرح منن ڪندو، اُنجي دواران مان گ يان يڳيه ۾ پوجڻ يو گيه ٿيندس معني اهڙو يڳيه جنهن جو ڦل گيان آهي، جنهنجو سوروپ اڳير ئي پڏايو ويو آهي جنهنجو تاتپرج آهي - ساكياتڪار سان ملڪ واري ڄاڻ، اهو منهنجو نشڪل متو آهي.

شِدْوَاوَانَنَسْوَيَشَّاَپِي شِرِّدُوْيَاَدَپِي يوَذَرَهُم

سَوَّاَپِي مَكَتَهُ شُپَانَلَهُوكَانِپِرَاِنُوْيَا تِپِيَّيَكَرَمَّثَام

”شِرَّدَاِنَسَوَّيَشَّاَپِي شِرِّدُوْيَاَدَپِي يوَذَرَهُم سوپي مكته شپانللهوکانپراپنويا تپييڪرمثام (٧١) جيڪو پرش شردا سان پريل ۽ حسد کان رهت ٿي رڳو ٻڌندو اهو به پاپن کان مڪت ٿي اُتم ڪرم ڪرڻ وارن جي سريشت لوڪن کي پراپت ٿيندو. ارتات ڪندی به پار نه لڳي ته ٻڌندو رهي، اُتم لوڪ تڏهن به آهي، ڇاڪاڻ ته هو چت ۾ اُنهن اپديشن کي گرهن ته ڪري ٿو. هتي سنهت کان ايڪهتر تائين پنجن سلوڪن ۾ يڳوان شري ڪرشٽ اهو ٻڏايو ته گيتا جو اپديش بنا اڌكارين کي نه ٻڌائڻ گهرجي، ڇاڪاڻ جيڪو شرداowan آهي اُن کي ضرور ٻڌائڻ گهرجي، جيڪو ٻڌندو اهو يڳت مونکي پراپت ٿيندو، ڇاڪاڻ ته تمام ڳجهي ڪٿا ٻڌي جو پرش اُن ٿي هلن لڳي ٿو. جو يڳتن کي ٻڌائيندو، اُن کان وڌيڪ پيارو چوڻ وارو منهنجو ڪوئي ڪونهي. اڀاس ڪندو، ان دواران ئي گيان سان پوچيو ويندس. يڳيه جو ڦل ئي گيان آهي. جو گيتا جي انوسار ڪرم ڪرڻ ۾ اسمرت آهي، پر شردا سان ٻڌندو، اهو به پچ لوڪن کي پراپت ٿيندو. اهڙي طرح يڳوان شري ڪرشن هن جي ٻڌڻ ۽ چوڻ ۽ اڀاس ڪرڻ جو ڦل ٻڏايو آهي. سوال پورو ٿيو. هاڻي پچاڙي ۾ هو ارجن

یتارت گیتا : شریمد پکوڈ گیتا

کان پکن ٿا ته ڪجهه سماجهه هر آيو؟

کچھ دهت چھوٽ پارٿ تَوَيْئِيَوْ کا گر پڻ چیت سا

کچھ دهت چھوٽ پارٿ تَوَيْئِيَوْ کا گر پڻ چیت سا

”کچھ دهت چھوٽ پارٿ تَوَيْئِيَوْ کا گر پڻ چیت سا

کچھ دهت چھوٽ پارٿ تَوَيْئِيَوْ کا گر پڻ چیت سا (۷۲)

هي پارٿ ! ڇا تو منهنجا هي وچن ایکا گرچت ٿي پڏا!

ڇا منهنجو اڳيان مان اُپن ٿيل موھ نشت ٿيو؟ ان تي ارجن

چيو

### ارجُن उवाच

नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युता।

स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव॥७३॥

### ارجُن ओवाज

”نَسِشْتُو مَوْهَكَه سِمِرِ تِرَلِيدَا تِوْتِپِرِ سَادَا نَمِيَا چُهِيَّت

سِشْتُو سِمِيِّي گَتَسِنِدِيَّهَكَه كَرِشِيِّي وَچَنَّيِّ تَوَ“ (۷۳)

اچيٽ ! تو هانجي ڪرپا سان منهنجو موھ نشت ٿي ويو

آهي . مو نكي سمرتي پراپت ٿي آهي . (جيڪو رهسيه پرييو گيان

منؤ سمرتي - پرمپرا کان هلايو هو اُن کي ارجن پراپت ڪري

ور تو) هاڻي مان شنکا کان رهت ٿيو آهيان ه تو هانجي آگيا جو

پالن ڪندس . جڏهن ڪ سينا جي جاچ وقت ٻنهي سينائن هر

پنهنجن ماڻهن کي ڏسي ارجن وياكل ٿي ويو هو . هن وينتي

ڪئي ته هي گوندا پنهنجي پروار کي ماري اسين سکي ڪيئن

ٿيندا سين ؟ ا هڙيءَ يد ڪرڻ سان پوتر ڪل ڏرم نشت ٿي ويندو ،

پندن جي ڪريا گم ٿي ويندي، ورڻ سنڪر اُپن ٿيندو .

اسين ماڻهو سمجھدار ٿي به پاپ ڪرڻ لاءَ تيار ٿيا آهيوون .

چو نه ان کان بڪڻ جو اپاءَ ڪريون . شسترا داري هي ڪوره

مونکي شستره بنا مونکي رڻ پوميءَ هر ماري چڏين، اُ هو  
مارڻ به سنو آهي. گووند! مان يڌ نه ڪندس - چئي هو رت  
جي پنهڻين پاڳ هر بي هي رهيو.

اهڙي طرح گيتا هر ارجن شري يو گيشور شري ڪرشٽ جا  
سامهون سوالن جوابن جي ڏوري ڪڙي ڪري چڏي. جيئن اڌياءُ  
٧-٢ اهو سادن منهنجي لاءُ چو جنهن هر پرم آذار کي پراپت  
ڪريان؟ ٤-٥-٢ ستٽپرگيه جا لڪشٽ ڪھڑا آهن؟ ٣-١ جڏهن  
توهانجي درشتيءَ هر گيان يو گم سريشت آهي ته مونکي پينڪر  
ڪرمن هر چو ٿا لڳايو؟ ٣-٦ منش نه چاهيندي به منهنجي  
پرير ڻاسان پاپ جو ونهوار ڪري ٿو؟ ٤-٤ توهانجو جنم ته  
هائي ٿيو ه سورج جو جنم ڏadio پراطٽ آهي ته مان اهو ڪيئن  
مڃيان ته ڪلپ جي آد هن يو گم کي توهان سورج کي بدایو  
هو؟ ١-٥ ڪڏهن توهين سنياس جي ساراهه ٿا ڪريو، ته ڪڏهن  
نشڪام ڪرم جي. انهن مان هڪڙو نشچو ڪري چئو جنهن  
سان پرم آسري کي پراپت ڪريان؟ ٦-٣-٥ من چنچل آهي؛  
پوءِ منجهيل ڪوشش ڪرڻ شرداوان پرش توهانکي نه پراپت  
ٿي ڪھڙي درگتيءَ کي پراپت ٿئي ٿو؟ ١-٢ ٨-٤ گووند! جنهنجو  
تهان ورنن ڪيو، اُ هو برهم چا آهي؟ اُ هو اڌياتم چا آهي؟  
اڌيدئيو، اڌييوت چا آهي؟ هن شرير هر اڌيئي ڪير آهي؟ اهو  
ڪرم چا آهي؟ انت ويلي تون ڪھڙي طرح جاڻ هر اچين ٿو؟  
ست سوال ڪيا. اڌياءُ ١٧-١٠ هر ارجن جي چڳياسا ڪئي ته  
نرنتر چنتن ڪرڻ وقت مان ڪھڙن پاؤن دواران توهانجو سمرن  
ڪريان؟ ٤-١١ هن وينتي ڪئي ته جن ويوقتین جو توهان  
ورڻن ڪيو اُنهن کي مان ظاهري ڏسٽ چاهيان ٿو. ١-٢  
جيڪي انيئينه شردا هر لڳل پڳت جن چڱي طرح توهان جي

اپاسنا ڪن ٿا ئه بيا جي اکشر اوبيكت (نرگن) جي اپاسنا ڪن ٿا، انهن ٻنهي ۾ اُتم يوگويتا ڪير آهي؟ ۱۴-۲۱ ٽن گڻن کان پري پرش ڪھڙن لڪشٽن سان مليل ٿئي ٿو ئه منش ڪھڙي اپاء سان انهن ٽن گڻن کان الڳ ٿئي ٿو؟ ۱-۱۷ جو منش متئي ٻڌايل شاستر وڌيءَ کي تيماڻي پر شردا سان ملي پوجا ڪن ٿا. قرباني ڪن ٿا. انهن جي گتي ڪھڙي ٿئي ٿي؟ ۱۸-۱ ٿه هي مهاباهو! مان تيماڻي سنياس چي ساچي سوروب کي آهستي آهستي سلسليوار چائڻ چاهيان ٿو.

اهڙي طرح ارجن سوال ڪندو رهيو. جو هو پاڻ نٿي ڪري سگهيو انهن ڳڄهن رهسيين کي ڀڳوان خود ظاهر ڪيو، ڏيڪاريyo. انهن جو سماڏان ٿيندي ئي هو سماڏان کان پوءِ سوالن کان الڳ ٿيو ئه چيو ٿه گوند! هاڻي مان توهانجي آگيا جو پالن ڪندس. حقiqet ۾ هي سوال منشن جي لاءِ آهن. انهن سڀني سوالن جي سماڏان بنا ڪوئي به ساڌڪ پوتر پت تي اڳيان قدم وڌائي نه سگهندو. هاڻي ستگزو جي آگيا جو پالن ڪرڻ جي لاءِ، اُتم پت جي لاءِ سمپورڻ گيتا جو ٻڌڻ تمام ضروري آهي. ارجن جو سماڏان ٿي ويو. تنهن سان گڏ يوگيشور شري ڪرشٽن جي پوتر مكاروند مان پوتر واڻي جي ورکا ٿي. ان تي سنجيهر چيو؟

(يارهين اڌياءَ ۾ ورات روپ جو درشن ڪراڻ ڪان پوءِ يوگ يشور شري ڪرشٽن چيو هو ٿه ارجن! اينيه ڀڳتيءَ دواران مان ان طرح ڏسڻ جو (جيئن تو ڏنو آهي) تتو سان چائڻ ئه پرويش ڪرڻ ۾ آسان آهيان (۱۱-۵۴).

اهڙي طرح درشن ڪرڻ وارا ساكيات منهنجي سروب

کي پراپت ٿين ٿا ئه هاڻي هتي ارجن کان پڙن ٿا چا  
تنهنگو موھ نشت ٿيو؟ ارجن چيو ته منهنگو موھ نشت  
ٿي ويو. مان پنهنجي سمرتى کي پراپت ٿي ويو آهيائان.  
توهين جيئن چوندا، اُھوئي ڪندس. درشن سان گڏ ته  
ارجن کي مڪت ٿي وجڻ كپندو هو. حقيقت ۾ ارجن جو  
جيڪي ٿيڻهو اُھو ٿي ويو پر شاستر ڀوپيشيه ۾ ايندڙ  
پيڙھين لاءِ ٿيندا آهن. ان جو اُپيوگه هر ڪنهن لاءِ ئي  
آهي.

### سنجيئه اُواچ

इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः।  
संवादमिममशौषमद्भूतं रोमहर्षणम्॥७४॥

### سننجيئه اُواچ

”اٽيڪير واسديوسيم پارشسيئه په مهاتمنه  
سنوا دِمَمَّشِرَئُو شَمَدِيَّتَمِ رومَكَرَشَكَير (۷۴)

ان طرح مون واسديوءِ مهاتما ارجن (ارجن هڪ مهاتما  
آهي، يوگي آهي، سادڪ آهي، نه ڪوي ڏنشداري جو مارڻ لاءِ  
بينو آهي. هاڻي مهاتما ارجن) جي ان چيد پريل ئه من کي موج  
ڏيندڙ سنوا د (گفتگو) کي بڌو. توهان ۾ بڏڻ جي سمرتى ڪيئن  
آئي؟ اڳيان چون ٿا:

વ्यासप्रसादाच्छुतवानेतदृह्यमहं परम्।

योगं योगेश्वरात्कृष्णात्साक्षात्कभयतः स्वयम्॥७५॥

”وياسپرسادا چُنوانپيٽدر هِيَمَهَكَير پَرَمِ  
يوگَير يوگييشورا تِڪر شٽا تِساکيا تِڪتِيَّةَ هَم سوَيَّه (۷۵)  
شي وياس جيءِ جي ڪرپا سان، هنجي ڏنل درستيءِ سان  
مون هن پرم رهسيه پرئي يوگه کي ساکيات شي يوگيشور

શ્રી કૃષ્ણ જી પોત્ર મક માન બદ્વો. સંભિલ શ્રી કૃષ્ણ કી બોગીશુર મજી તો. જીકો પાણ બોગી હબ્જી આ બીન કી બે બોગી પરદાન કૃથી જી સુરતી રકન્દો હબ્જી, એ બોગીશુર આહી.

રાજનસંસ્મૃત્ય સંસ્મૃત્ય સંવાદમિમમદ્ધુતમ्।

કેશવાર્જુનયો: પુણ્ય હૃષ્યામિ ચ મુહુરુહુ: ॥૭૬॥

”રાજનસંસ્મૃત્ય સંસ્મૃત્ય સંવાદમિમમદ્ધુતમ्  
કીશ્વાર જન્મિઓ હુદ્ધીમ હરિશિયામિ ચે મુહુર્મહેન્દ્ર  
હી રાજન! કીશ્વો આરજન જી હેન પરમ કલ્યાણકારક આદ્યેન  
રહ્યો આહીયાન. હાથી હેન સન્નોદ કી હમિશિન્દે યાદ રક્ત ગહેરજી આન યાદગિરી, સુરતી સાન પરસ્ન રહ્થી ક્પી. હાથી અન્હન્ગ્યી સુરૂપ જો સુર્થ કર્યી સંભિલ છુન તા:

તચ્ચ સંસ્મૃત્ય સંસ્મૃત્ય સ્ફુરમત્યદ્ધુતં હોઃ।

વિસ્મયો મે મહાન રાજનહૃષ્યામિ ચ પુન: પુન: ॥૭૭॥

”તચ્ચે સંસ્મરત્ય સંસ્મરત્ય એ રૂપ્યમત્યિદ પુન્ન હર્ય હે  
ઓસ્મિયો મી મહાન રાજનહરિશિયામિ ચે પુન્ન હેન્દ્ર હેન્દ્ર (૭૭)  
હી રાજન! હરી જી (જો શ્વિ એશ્વ સ્પિની જો હર્થ જો હર્થ જો હર્થ જો  
કન તા) કર્યી મન્હન્ગ્યી ચ્ચત મહાન આશ્કર્યે ત્યે તો આ માન  
ઓર્ય ઓર્ય ખોશ ત્યાન તો. એષ્ટ જો સુરૂપ ઓર્ય ઓર્ય યાદ કૃથી  
જી ઓસ્તો આહી. એન્ટ સંભિલ નરન્યે ડ્યિન તા:

યત્ર યોગેશ્રજ્ઞવર: કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ।

તત્ર શ્રીવિજયો ભૂતિર્ધૂવા નીતિર્મતિર્મમ ॥૭૮॥

”યિતર બોગીશુરહે કર્ષણ્ણો યિતર પારતી દન્નર્ડરહે  
તિતર શરીર વિજિયો પુંઠર દર્રો નીતિતિર મની મરમ (૭૮)  
રાજન! જતી બોગીશુર શ્રી કૃષ્ણ એ દન્નશ દારી એ રાજન

(ڏيان ئي ڏنڍش آهي ء اندرین جي درجهاتئي گانديو آهي معنوي استرتا سان ڏيان ڏرڻ وارو مهاتما ارجن) آهي، اُتي ئي "شريمه" ايشوريه، وجيم - جنهن جي پنهيان هار نه آهي، ايشوريه ويوتي ء هلنندڙ سنسار ۾ اچل رهڻ واري نيتني آهي. اهو منهنگو مُمْت آهي، وبيچار آهي.

اچ به ڏنڍداري ارجن آهي ڪونه، هيء نيتني، وجيم ويوتي ته ارجن تائيين سڀمت رهجي ويئي. اُن سميم جي وارتا آهي اها. هيء ته دواپير ۾ ئي سماپت ٿي ويئي؟ پر اهڙي ڳالهه نه آهي. يوگيشور شري ڪرشن ٻڌايو ته مان سڀ ڪنهن جي هرديه ديش ۾ نواس ڪريان ٿو. توهان جي هرديه ۾ به اُهو آهي. انوراگ (پيار) ئي ارجن آهي. انوراگ توهانجي انتهڪرڻ جي اشت ديو سان لڳ جو نالو آهي، جيڪڏهن اهڙو انوراگ (پريم) توهان ۾ آهي ته سدائين توهانجي حقيقي وجيم آهي ء اچل استشي ڏيارڻ واري نيتني به سدائين رهندي ڪڏهن نه آهي؟ جيستائين پراطي رهندما پرماتما جو نواس اُنهن جي هردي ديش ۾ رهندو، ويأكل آتما اُن کي پائڻ لاءِ آتو هوندو ء اُنهن مان جنهن جي به هردي ۾ اُنكى پائڻ جو چاهه اُندو اُهو ئي ارجن جي درجي جو ٿيندو ڇاڪاڻ ته انورا ڳهئي ارجن آهي. هاڻي هرڪو ماڻهو هن جو اڌكاري بلهجي سگهي ٿو.

### تاقپرج

هيء گيتا جو آخرين اڌياءُ آهي. شروع ۾ ئي ارجن جو سوال هو ته پرييو ! مان تياڳهء سنياس جي پيدء سوروب کي چاڻ چاهيان ٿو. يوگيشور شري ڪرشن ان تي چار هلنندڙ متن جي چرچا ڪئي. انهن ۾ هڪ صحيح به هو. ان ۾

مليل جليل نرنير ئي يوگيشور شري ڪرڻه ڏنو ته يگي، دان  
 ئ قپ (تپسيما) ڪنهن ۾ وقت تياڳن لائق نه آهي. اهي  
 سياڻن کي به پوتر ڪرڻ وارا آهن. انهن ٿنهي کي رکي  
 انهن جي وروڌي وڪارن جو تياڳه ڪرڻ ئي سچ پچ تياڳه  
 آهي. اهو ساتوڪ تياڳه آهي. ڦل جي اچا رکي تياڳه ڪرڻ  
 راجسي آهي ئ موهه جي وس ٿي مقرر ڪرمن ڪرڻ جو تياڳه  
 ـ ڪرڻ تامسي تياڳه آهي ئ سنياس تياڳه جي مٿئين کان  
 مٿئين اوستا آهي. مقرر ڪرم ۽ ڏيان مان مليل سکم ساتوڪ  
 آهي. اندرین ۽ وشين جو ڀوڳه راجس آهي ئ اچا پوروڪ ان  
 جي اُپتي کان رهت دکه ڏيڻ وارو سک تامسي آهي.

منش ماتر دواران شاستر جي انوسار يا اپه بتڙ ڪرم  
 ٿيڻ جا پنج ڪارڻ آهن. ڪرتا (من)، آهستي آهستي ڪرڻ  
 (جنھن جي دواران ڪيو وڃي ٿو. شڀ پار لڳي ٿو وڃي ته  
 ووبك، ويراڳه، شم، دم ڪرم آهن. اشڀ پار لڳي ٿو ته  
 ڪام، ڪرود، راڳه، دويش وغيره ڪرم (تىندا) گهڻن قسمن  
 جون اچائون (اچائون اندت آهن، سڀ پورڻ ٿي نه  
 سگهنديون. فقط اها اچا پورڻ تىندي آهي، جنهن سان گڏ  
 آدار ملي ويندو آهي) چوٿون ڪارڻ آهي آدار (ساڏن) ۽  
 پنجون ڪارڻ آهي دئيو (پرالٻڌ يا سنسڪار) هرڪ ڪاريءه  
 ٿيڻ ۾ اهيئي پنج ڪارڻ آهن، پوءِ به ڪيو ليه سوروپ  
 پرماتما کي ڪرتا مجي ٿو، اهو موڙه بُڏي جيو سچ نتو  
 سمجھي معنلي ڀگوان نتو ڪري، جڏهن ڪ اڳيان هو چئي  
 آيو آهي ته ارجن! تون نمت ماتر ٿي ڪڙو رهه. ڪرتا ڏرتا  
 ته مان ئي آهيان. آخر ۾ اُنهن مهاپرشن جو مقصد چا  
 آهي؟

حقیقت ۾ پرکرتی ۽ پرش جي وچ ۾ هڪ من موھڪ سیما آهي. حد آهي. جیستائین منش پرکرتی ۾ ورتی ٿو، تیسنتائین مايا پریریٹا ڪري ٿي ۽ جڏهن اُن کان متی چڙھي اشت ۾ سمرپت ٿي وچي ٿو ۽ اُهو اشت جڏهن هردیه دیش سان رَٿي ٿي ٿو وڃي، پوءِ ڀگوان ڪندو آهي. انهيءَ سطح تي ارجن هو، سنڌجيم به هو ۽ سڀ ڪنهن کي هن درجي تي پهچڻ جو وڌان آهي. هاڻي ڀگوان پریرٺا ڪن ٿا. پورڻ گياتا مهاپرش چاڻڻ جي وڌي ۽ چاڻو پرماتما انهن ٿنھي جي سنیوگ سان ڪرم ۾ پریرٺا ملي ٿي. تنهنکري ڪنهن انپوي مهاپرش (ستگزو) جي سنگت ۾ سمجهڻ جي ڪوشش ڪرڻ کپي.

ورڻ ويستا جي سوال تي چوٿين پيری ڪلندي يو گيشور شري ڪرشن ٻڌايو. اندرین جو دمن، من کان شمن، ايڪاڳرنا، شرير وائي ۽ من کي اشت جي انوروب تپائڻ، ايشوري جانڪاري جي ڏارا، ايشوري آديش تي هلن جي سمرٽي وغيره برهم ۾ پرويش ڪرائڻ واريون لياقتون برهمنڻ درجي جا ڪرم آهن. بهادري، پنيان نه هنڻ جو سڀاءُ، سڀني پاون ۾ سوامي پاوا، ڪرم ۾ پورت رهڻ جي عادت کتري درجي جو ڪرم آهي ۽ اندرین کي ستنيالٽ، آتمڪ سمپتيءَ کي وڌائڻ وغيره وئشيه درجي جا ڪرم آهن ۽ شيوا شودر شريطيءَ جا ڪرم آهن. شودر جي معني آهي الپيئر. الپيئر ساڌڪ جو مقرر ڪرم ۾ به ڪلاڪ چنن ۾ ويهي ڏههه منت به پنهنجي پکش ۾ نتو پائي. شرير ضرور وينو آهي، پر جنهن من کي ٿڪائڻ کپي. اُهو تم هوا سان ڳالهيوں ڪري هيو آهي. اهڙي ساڌڪ جو ڪلياط ڪيئن ٿيندو؟ هن کي پاڻ کان متی اوستا وارن جي شيوا ڪرڻ گ

هرجي يا سترگروءَ جي آهستي آن ھر به سنسكارن جو سرجن ٿيندو، رفتار پڪڙيندو. هاڻي هن الپگيه جو ڪرم شيوا سان ئي شروع ٿئي ٿو. ڪرم هڪڙو ئي آهي. مقرر ڪرم، چنتن. ان جي ڪرتا جا چار درجا اتي اُتم، اُتم، مذيم ۽ نشڪرشت ئي برهمط، كتري، وئيشم ۽ شودر آهن. منش کي نه بلڪ گلن جي ذريعي ڪرم کي چئن ڀاڱن ھر وراهيو ويو آهي. گيتا ھر چيل ورڻ ائين ئي آهن.

تَتِوَ کي صاف ڪندي اُنهن چيو ته ارجن! اُن پرم سڌيءَ جي وڌي بُڌائيندس، جا گيان جي پرانشتا آهي. وويڪ ويراڳ، شمر، دم ڏارا واهڪ چنتن ۽ ڏيان جي پرورتي، برهم ھر پرويش ڏيارڻ واريون سڀ يوگيتائون جڏهن پوري طرح پچي ٿيون وجن، ڪام، ڪروڻ، موهر، راڳ، دويش وغيره پرڪري ھر گھسيتي رکڻ واريون پرورتیون جڏهن پوريءَ طرح شانت ٿي وجن ٿيون، اُن يوگيتا جو نالو پرا پيگتني آهي. پرا پيگتنيءَ دواران ئي هو تَتِوَ کي جاڻي ٿو. تَتِوَ آهي چا؟ بُڌايانئون جو مان آهييان، جن وپونين سان ملييل آهييان. اُنكى چاڻي ٿو ارتات پرماتما جو آهي، لڪل، پوتر، نه بدلجنڌڙ جَنْ الوَكَّ گلن ڈرمن وارو آهي، ان کي چاڻي ٿو، ۽ چاڻي هو هڪدم مون ھر استت ٿي وجي ٿو. هاڻي تَتِوَ آهي پرم تَتِوَ نم ڪ پنج يا ٥٠ تَتِوَ. پراپتيءَ سان آتما اُن سوروب ھر استت ٿي وجي ٿو ۽ اُنهن گلن ڈرمن سان مليي ٿو وجي.

ايشور جو نواس بُڌايندي يوگيشور شري ڪرشٽ چيو ارجن! اُهو ايشور سڀني ڀوتن جي هرديه ديش ھر نواس ڪري ٿو، پر مايا روپي ينتر جي ڏند ھر ماظھو ڀتكى رهيا آهن، ان

ڪري نٿا چاڻن. هاڻي ارجن ! تون هرديه ۾ استت آن ايشور جي شرط ۾ اچ. تون مونکي پراپت ٿينديں. اهو رهسيه جيڪو اڏڪاري نه آهي تنهن کي نه ٻڌائڻ كپي. جيڪو پڳت ڪونهي آن کي نه چوٽ گهرجي ليڪن جو ڀڳت آهي آن کي ضرور ٻڌائڻ گهرجي. جي آن کان پري رهيو تم آنجو ڪلياڻ ڪيئن ٿيندو؟ انت ۾ يو گيشور شري ڪرشن پاڻيو. ارجن! مون جيڪي ڪجهه چيو آن کي تو چڱي طرح ٻڌو. سماجھيو، تنهنجو موهم نشت ٿيو يا نه؟ ارجن چيو ڀڳوان! منهنجو موهم نشت ٿي ويو آهي. مان پنهنجي يادگيري کي پراپت ٿيو آهياب. توهين جو ڪجهه چئو ٿا. آهو ئي سٽيه آهي ء مان هاڻي اُهو ئي ڪندس.

سنجه، جنهن بنهي جي سنواڊ کي چڱي طرح ٻڌو آهي، پنهنجو نرنئه ڏئي ٿو ته شري ڪرشن مهايو گيشور ء ارجن هڪ مهاتما آهي. آنجنجو سنواڊ برابر ياد ڪري هو خوش ٿي رهيو هو . هاڻي هن جو سمرط ڪندو رهط گهرجي ڏيان ڪندو رهجي. جتي يو گيشور ڪرشن آهن. جتي مهاتما ارجن آهي، اُتي شري آهي. وجيه ويٺي ڏرو نيتني به اُتي آهي. سرشتيء جون نيتيون اچ آهن ته سڀائي بدلجنديون . ڏرهوڪ ته هڪ ماتر پرماتما ئي آهي. آن ۾ پرويش ڏيارڻ واري نيتني ڏرو نيتني (سچي نيتني آهي. جيڪڏهن شري ڪرشن ء ارجن دواپر ڪال جا خاص مجيما وجن ته اچ به تڏهن ته اچ نه ارجن آهي نه شري ڪرشن. توهان کي نه وجبه ملڪ كبي ء نه ويٺي. تڏهن ته گيتا توهانجي لاءِ وئرت آهي. پر نه شري ڪرشن هڪ يو گي هو. انوراڳه سان پيريل هردي وارو مهاتما ئي ارجن آهي. آهي سدادئين رهن ٿا ء هميشهه رهندا. شري ڪرشن پنهنجي

واقفيت ڏيندي چيو ته مان آهيان تم اوينکت (لكل)، پر جنهن پاوا کي پراپت آهيان، اُهو ايشور سڀ ڪنهن جي هردي ڪوش ۾ نواس ڪري ٿو. هو سدائين آهي ئه رهندو. سڀ ڪنهن کي آنجي شرط ۾ وڃيو آهي. شرط ۾ وڃڻ وارا ئي مهاتما آهن، انوراگي ئه انوراگم ئي ارجن آهي تنهن ڪري ڪنهن استتپر گ يه مهاپرش جي شرط ۾ وڃڻ تمام ضروري آهي، چاكاڻ ته اُهو ئي هنكى اُتساهه بخشيندڙ آهي.

هن اذياء ۾ سنیاس جي سروپ کي صاف ظاهر ڪيو ويو آهي ته سڀ ڪجهه تياڳڻ ئي سنیاس آهي. صرف ويسن ڏارڻ ڪرڻ ئي سنیاس نه آهي، بلک ان سان گڏ ايڪانت ۾ چنتن ڪندي مقرر ڪرم ۾ پنهنجي شكتي سماجھي يا سمپورن سان گڏ هميشه ڪوشش ۾ لڳل آپراري آهي. پراپتي سان گڏ سمپورن ڪرمن جو تياڳ ئي سنیاس آهي، جو موکش وانگر آهي. اها ئي سنیاس جي چرم سيمما آهي ا هاڻي -

”اوم تَتِسِدِ تِمِ شريمد ڀڳود گيتا سُو پِنْشِتِسُو بِرْهُم وديا يام يوگشاستري شري ڪرشن ارجنسموادي ”سنیاس يوگو“ ناماشتا دشو ذيايي هم ۱۱۱۸

ان طرح شريمد ڀڳود گيتا روپي اُپنشد ايوم برهم وديا ئه يوگ شاستر وشيه شري ڪرشن ارجن جي سنواد ۾ ”سنیاس يوگ“ نالي ارجون اذياء پورن ٿئي ٿو.

إٽي شريمتپرمهنس پرمانندسيه شيشيه سوامي ازگزاند ڪري شريمد ڀڳود گيتا يا ”يٽارت گيتا“ پاشيه ”سنیاس يوگ“ نام اشتادشوديائمه : ۱۱۱۸

۱۱ هري اوم تِت سِت ۱۱